

SPARC/Sec/SE/2021-22/45

September 04, 2021

National Stock Exchange of India Ltd., Exchange Plaza, 5th Floor, Plot No. C/1, G Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai – 400 051. BSE Limited,
Market Operations Dept.
P. J. Towers,
Dalal Street,
Mumbai - 400 001.

Ref: Scrip Code: NSE: SPARC; BSE: 532872

Dear Sir/ Madam,

Sub: Submission of Newspaper advertisement under Regulation 30 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations")

This is to inform you that a public notice by way of an advertisement has been published in all the editions (English Language) of the Financial Express dated September 04, 2021 and in Ahmedabad Edition (Gujarati Language) of the Financial Express dated September 04, 2021, regarding i) Notice of the 16th Annual General Meeting of the Company for the financial year ended March 31, 2021, to be held on Wednesday, September 29, 2021 by Video Conferencing/ Other Audio Visual means, ii) E-voting, and iii) Book Closure.

Pursuant to Regulation 30 read with Schedule III and Regulation 47 of the Listing Regulations, we enclose herewith copy of the advertisement published in the following newspapers dated September 04, 2021:

- 1. Financial Express Mumbai Edition (English Language)
- 2. Financial Express Ahmedabad Edition (English Language)
- 3. Financial Express Ahmedabad Edition (Gujarati Language)

This is for your information and records.

Thanking you,

Yours faithfully,

For Sun Pharma Advanced Research Company Limited

**Dinesh Lahoti** 

**Company Secretary and Compliance Officer** 

**ICSI Membership No.: A22471** 

Encl: As above

**FINANCIAL EXPRESS** 

Means ("OAVM").

**AEGIS LOGISTICS LIMITED** 

Regd. Office: 502 Skylon, G.I.D.C., Char Rasta, Vapi 396 195, Dist. Valsad, Gujarat Corp. Office: 1202, Tower B, Peninsula Business Park, G. K. Marg, Lower Parel (W), Mumbai - 400013 Tel.: +91 22 6666 3666 Fax: +91 22 6666 3777 E-mail: gegis@gegisindia.com Website: www.gegisindia.com

NOTICE OF RECORD DATE FOR FINAL DIVIDEND AND UPDATION OF SHAREHOLDER DETAILS **NOTICE** is hereby given that pursuant to the applicable provisions of the Companies Act, 2013 and Rules made thereunder, the 64th Annual General Meeting ("AGM") of Aegis Logistics Limited will be held on

Further, Kindly note that dividend as recommended by the Board of Directors of the Company at their Meeting held on May 27, 2021 @ 200% i.e. Rs. 2.00 per share (face value of Re.1 each), if declared by the members at the ensuing Annual General Meeting will be paid to those eligible members whose name appear on the Registrar of Members as on the Record Date i.e. Friday, September 17, 2021. Kindly note that the said dividend, will be paid on or before Thursday, November 18, 2021 if declared by

Thursday, October 21, 2021 at 5:00 p.m. (IST) through Video Conference ("VC") or Other Audio Visual

the Members, at the ensuing Annual General Meeting Further it is hereby given that pursuant to the SEBI Circular SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, the Company is providing the simple and error free facility through web-portal for registration of e-mail ID along with bank details for the shareholders holding shares in physical form.

The Shareholders holding shares in physical form and who have still not registered their e-mail ID, PAN along with bank details with the Company can get their e-mail IDs, PAN and Bank details registered with the Company's Registrar & Share Transfer Agent, Link Intime India Pvt. Ltd. ("Link Intime"), by browsing the link: https://linkintime.co.in/emailreg/email register.html and by following the registration process as guided thereafter, on or before Friday, September 17, 2021 (Record date for determining entitlement of members eligible to receive dividend for the Financial year 2020-2021) so as to receive the Annual Report for the financial year 2020-21 and e-voting details on e-mail and to receive the dividend electronically in your bank account registered with link Intime. The Shareholders holding shares in demat form are advised to keep their e-mail ID, PAN and Bank details

updated with their depository participant on or before Friday, September 17, 2021 (Record date for determining entitlement of members eligible to receive dividend for the Financial year 2020-2021)to receive the Annual Report of the Company and e-voting details on e-mail and to receive the dividend electronically in your bank account. For Aegis Logistics Ltd.

Place : Mumbai Date: September 3, 2021

Monica Gandhi Company Secretary

# **B.C. POWER CONTROLS LIMITED**

(CIN: L31300DL2008PLC179414) Registered Office: 7A/39, WEA Channa Market, Karol Bagh, New Delhi-110005 Email: info@bonlongroup.com, Website: www.bcpowercontrols.com Phone: 011-47532795, Fax: 011-47532798 Notice - 13"Annual General Meeting

This is to inform that, the 13" Annual General Meeting ("AGM") of B.C. Power Controls Limited ("the Company") will be held on Tuesday, 28" September, 2021 at 01:00P.M., through video conferencing (VC)/ other audio visual means (OAVM) in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the rules made there under, read with Ministry of Corporate Affairs (MCA) Circular 14/2020, 17/2020, 20/2020 and 02/2021 dated 8" April 2020, 13" April, 2020, 5" May 2020 and 13" January 2021 respectively issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circular Nos. SEBI/HO/CFD/CIR/P/2020/79 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 12th May 2020 and 15" January 2021 respectively issued by the SEBI, to transact the business as set out in the notice of AGM which will be sent in due course of time.

Members may note that, in view of the continuing COVID-19 pandemic the AGM will be held through VC/OAVM in compliance with the above stated circulars and in furtherance of Go-Green initiative of the government, the Notice of the 13th AGM and Annual Report for the financial year 2020-21, will be sent through electronic mode only to those members whose email addresses are registered with the Company / Depository Participant/ Registrar and Transfer Agent ("RTA"). The members attending the meeting through VC or OAVM shall be counted for the purpose of quorum under section 103 of the Act. The Company is also providing e-voting and remote e-voting facility to all its members similar to earlier practices. The e-copy of the notice of the 13"AGM along with the Annual Report for the FY 2020-21 of the Company will be available on the website of the Company at www.bcpowercontrols.com and also be available on the website of the BSE Limited at

www.bseindia.com . in due course of time The Members can attend and participate in the AGM through VC/OAVM only. Detailed instructions for joining the AGM will be provided in the Notice of the 13"AGM. Accordingly, please note that no provision has been made to attend and participate in the AGM of the Company in person, to ensure compliance with the directives issued by the government

authorities with respect to Covid-19 pandemic. In case the email address is not registered with the Company / Depository Participant please follow the process of registering the same as mentioned below:

Physical 100% Shareholding of the Company is in De-mat Form, so this provision is not Holding applicable to the Company.

Demat | Please contact your Depositary Participant (DP) and register your email Holding address as per the process advised by DP or get temporarily registered with RTA of the Company Bigshare Services Private Limited, by clicking the link: www.bigshareonline.com/ForInvestor.aspx.

Please also update your bank detail with your DP for dividend payment by NACH if declare by company.

Members may also note that if your e-mail id is registered with the Company/Depository Participant, the login credentials for remote e-voting / e-voting during the AGM will be sent on the registered e-mail address along with the notice of the 13"AGM. However, members who have not registered their email-id can follow the procedure for registering e-mail id as mentioned above. Members may note that the detailed procedure for remote e-voting / evoting during the AGM is also mentioned in the notice of AGM.

The above information is being issued for the information and benefit of all the members of the Company and is in compliance with the MCA Circular(s) and the SEBI Circular.

Place: New Delhi Date: 03" September, 2021

Rajbir Sharma (Company Secretary)

For B.C. Power Controls Limited

# TENNECO FEDERAL-MOGUL GOETZE (INDIA) LIMITED

CIN: L74899DL1954PLC002452

Registered Office: DLF Prime Towers, 10 Ground Floor, F- 79 & 80, Okhla Phase- I, New Delhi- 110020 Corporate Office: 10" Floor, Paras Twin Towers, Tower- B, Sector- 54, Golf Course Road, Gurugram-12200. Website: www.federalmogulgoetzeindia.net; Tel.: +91 124 4784530; +91 11 49057597. Fax: +91 124 4292840, E-mail: investor.grievance@tenneco.com

NOTICE

The Notice is hereby given that the 66"Annual General Meeting ("AGM" of FEDERAL-MOGUL GOETZE (INDIA) LIMITED ("the Company") is scheduled to be held on Monday, September 27, 2021 at 11:00 A.M. through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM) in compliance with General Circular Nos. 14/2020 dated 8th April, 2020 17/2020dated 13" April, 2020, 20/2020 dated 5" may, 2020 and 02/2021dated 13" January, 2021 and all other applicable laws and circulars issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India (collectively referred to as "MCA Circulars"), and Securities and Exchange Board of India (SEBI)circulars dated 12th May, 2020 and 15th January, 2021 (collectively referred to as "SEBI Circulars") to transact the Ordinary and Special businesses as set out in the Notice calling AGM. Company's Registered Office i.e DLF Prime Towers, 10 Ground Floor, F- 79 & 80, Okhla Phase- I, New Delhi- 110020 will be deemed to

In compliance with the above said MCA and SEBI circulars, only electronic copies of the Notice of the AGM alongwith the Annual Report for the Financial Year 2020-21have already been emailed to all the shareholders whose email addresses are registered/available with the Company/Registrar and Transfer Agent ("RTA")/Depository Participants ("DP's"). The emailing of all Notices has been completed on 2" September, 2021. In terms of Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of

the Companies (Management and Administration) Rules 2014 Secretarial Standard-2 on General Meetings and Regulation 44 of the SEBI (Listing Obligations & disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, the Company is providing facility of voting by electronic means and the businesses set out in Notice of 66 Annual General Meeting, may be transacted through such voting. The facility of voting through electronic voting system shall also be made available during the meeting on the day of the AGM for those members who have not already cast their vote by remote e-voting. The Board has appointed Mr. Abhishek Bansal, Advocate as scrutinizer for conducting the voting in a fair and transparent manner.

a. Members holding shares either in physical or in dematerialized form as on the cut-off date i.e. 17"September, 2021 may cast their vote electronically on businesses as set out in the notice through such remote e-voting.

A person who has acquired shares and become a Member of the Company after the Notice was sent and holding shares as on the cutoff date i.e. 17"September, 2021, may obtain LOGIN ID and PASSWORD by sending a request at evoting@nsdl.co.in or Mr. J K Singla, Senior Manager, Alankit Assignments Limited, Alankit Heights 3E/7, Jhandewalan Extension, New Delhi-110055, Tel. No. +91 11 42641234, email: jksingla@alankit.com. However, if you are already registered with NSDL for remote e-voting then members may use their existing user ID and password for casting the vote.

The remote e-voting shall begin on Friday, September 24, 2021 at 09.00 A.M. and end on Sunday, September 26, 2021at 05.00 P.M. The remote E-voting shall not be allowed beyond 05.00 p.m. on Sunday, September 26, 2021. The facility for voting through electronic voting system shall also be

made available at the AGM and the Members participating in the AGM through VC/ OVAM who have not already cast their votes by remote e-voting shall be able to exercise their right in the meeting. Members whose names are recorded in the register of members or in

the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting or voting at Annual General Meeting.

Members may note that notice of the 66"Annual General Meeting and the Annual Report for the FY 2020-21 are also available on Company's website <a href="http://www.federalmogulgoetzeindia.">http://www.federalmogulgoetzeindia.</a> net/web/index.html, the website of NSDL www.evoting.nsdl.com as well as on the website of the stock exchange namely NSE & BSE and can be made available for inspection by writing to the Company at investor.grievance@tenneco.com.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Members and remote e-voting user manual for Members available at the downloads section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990. You may also send your queries/grievance relating to e-voting to Mr. J. K. Singla, Senior Manager, Alankit Assignments Limited, Alankit Heights 3E/7, Jhandewalan Extension New Delhi-110055, Tel. No. +91 11 42641234, email: jksingla@alankit.com.

The register of members and share transfer books of the Company shall remain closed from Monday, 20"September, 2021 to Monday, 27" September, 2021 (both days inclusive) for the purpose of 66th AGM.

For Federal-Mogul Goetze (India) Limited

(for the attention of Equity Shareholders of the Company)

NOTICE is hereby given that pursuant to Section 124 of the Companies Act, 2013 and the Investor Education and Protection Fund (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (the Rules), as amended, all the share(s) in respect of which dividend has not been paid or claimed for seven consecutive years or more and the dividend declared for Financial Year 2013-14, which remains unpaid or unclaimed for a period of seven

The details of shares and dividend liable to be transferred to IEPF Authority are placed on website of the Company at www.reliancecapital.co.in. Shareholders may note that the details uploaded by the Company on its website shall be deemed to be adequate notice for the purpose of transfer of shares to IEPF Authority pursuant to the Rules.

as stated above, on or before October 25, 2021, failing which the same shall be transferred to the IEPF Authority without any further notice.

to IEPF Authority including all benefits accruing on such share(s), if any, can be claimed back by them from IEPF Authority after following the procedure prescribed in the Rules. For any queries on the above matter, shareholders are requested to contact the Company's Registrar and Transfer Agent, KFin Technologies Private Limited Tel.:+91 40 6716 1500 Fax: +91 40 6716 1791, Toll Free No.(India):1800 4250 999. Email: rclinvestor@kfintech.com.

Date: September 1, 2021 Reliance Capital Limited CIN: L65910MH1986PLC165645 Regd. Office: Kamala Mills Compound, Trade World 7th Floor, B Wing, S. B. Marg, Lower Parel, Mumbai 400 013

Tel.: +91 22 4158 4000, Fax: +91 22 2490 5125

Infrastructure

Place: Mumbai

NOTICE

E-mail: rcl.investor@relianceada.com, Website:www.reliancecapital.co.in

(for the attention of Equity Shareholders of the Company) Sub.: Transfer of Equity Shares and Dividend of the Company to Investor Education and Protection Fund Authority

NOTICE is hereby given that pursuant to Section 124 of the Companies Act, 2013 and the Investor Education and Protection Fund (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (the Rules), as amended, all the share(s) in respect of which dividend has not been paid or claimed for seven consecutive years or more and the dividend declared for Financial Year 2013-14, which remains unpaid or unclaimed for a period of seven years shall be liable to be transferred to Investor Education and Protection Fund (IEPF) Authority, on or after November 6, 2021.

on website of the Company at www.rinfra.com Shareholders may note that the details uploaded by the Company on its website shall be deemed to be adequate notice for the purpose of transfer of shares to IEPF Authority pursuant to the Rules.

stated above, on or before November 2, 2021, failing which the same shall be transferred to the IEPF Authority without any further notice.

Shareholders may note that both the Unclaimed dividend and the share(s) transferred to IEPF Authority including all benefits accruing on such share(s), if any, can be claimed back by them from IEPF Authority after following the procedure prescribed in the Rules. or any gueries on the above matter, shareholders are requested to contact the Company's Registrar and Transfer Agent, KFin Technologies Private Limited Tel.:+91 40 6716 1500 Fax: +91 40 6716 1791, Toll Free No.(India):1800 309 4001, Email: rinfra.investor@relianceada.com.

Company Secretary & Compliance Officer

CIN: L75100MH1929PLC001530 Regd. Office: Reliance Centre, Ground Floor Walchand Hirachand Marg, Ballard Estate, Mumbai 400001 Tel.: +91 22 4303 1000, Fax: +91 22 4303 4662 E-mail:rinfra.investor@relianceada.com, Website:www.rinfra.com Sparco Sun Pharma Advanced Research Company Limited

Place: Mumbai

Date: September 1, 2021

Reliance Infrastructure Limited

Registered Office: Plot No. 5&6/1, Savli G.I.D.C. Estate, Savli - Vadodara Highway, Manjusar - 391775 Vadodara, Gujarat. Tel: +91 02667 666800; Corporate Office: 17/B, Mahal Industrial Estate, Mahakali Caves Road, Andheri East, Mumbai 400 093, Maharashtra, Tel: +91 22 6645 5645 Fax: +91 22 6645 5685 CIN: L73100GJ2006PLC047837 Website: www.sparc.life Email: secretarial@sparcmail.com

## NOTICE OF ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE NOTICE is hereby given that the Sixteenth Annual General Meeting ("AGM") of the

members of the Sun Pharma Advanced Research Company Limited ("Company") will be held on Wednesday, September 29, 2021 at 5:00 p.m. IST through Video Conferencing ("VC")/ Other Audio-Visual Means ("OAVM") without the physical presence of the members at a common venue, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 ("Act") and the rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), read with General Circular No. 14/2020 dated April 08, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 20/2020 dated May 05, 2020, and General Circular No. 02/2021 dated January 13, 2021 and other applicable circulars ("MCA Circulars") issued by the Ministry of Corporate Affairs ("MCA") and circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/ 2020/79 dated May 12, 2020 read with Circular No. SEBI/HO/CFD/CMD2, CIR/P/2021/11 dated January 15, 2021 and other applicable circulars, if any, ("SEBI Circulars") issued by Securities and Exchange Board of India ("SEBI") (MCA Circulars and SEBI Circulars collectively referred to as "relevant circulars"), to transact the businesses set out in the Notice convening the AGM. Members participating through the VC/OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103

The electronic copy of the Annual Report for the financial year 2020-21 along with the Notice of the AGM, will be emailed to all the members whose email addresses are registered with the Company's Registrar and Share Transfer Agent, Link Intime India Private Limited ("RTA")//Depositories, in accordance with the relevant circulars. The said Annual Report and Notice of the AGM shall also be made available on the website of the Company at <a href="www.sparc.life">www.sparc.life</a> and on the websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of the Central Depository Services India) Limited ("CDSL") at www.evotingindia.com, being the agency appointed by the Company for providing e-voting and VC/OAVM facility for the AGM. Members can attend and participate in AGM through the VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in Notice of the AGM. Members are requested to carefully read all the instructions detailed in the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting and

The Company is pleased to provide facility to its members, to cast their vote electronically ("remote e-voting") on the businesses as set forth in the Notice of the AGM. The remote e-voting period shall commence on Sunday, September 26, 2021 at 09:00 A.M. and ends on Tuesday, September 28, 2021 at 05:00 P.M. During this period, the members may cast their e-vote remotely by logging in as per login method provided below. The remote e-voting module shall be disabled by CDSL for voting thereafter. Pursuant to requirement of SEBI the e-voting is enabled for the demat account holders, by way of a single login credential, through their demat accounts/websites of Depositories/Depository Participants. The shareholders can login for e-voting during the AGM and join the AGM by VC/OAVM, in the same manner as given below. Detailed instructions/procedure for remote e-voting, e-voting during the AGM and joining AGM by VC/OAVM are provided in the Notice of the AGM.

# Login method for remote e-voting/e-voting during the AGM and joining AGM

of reform.	
Individual shareholders holding shares in Demat	Log
Shareholders holding shares in Physical and Non-Individual Shareholders holding shares in demat.	Log WV DP
Shareholders holding shares in Physical and Non-Individual Shareholders holding shares in demat who have not updated their PAN with the Company/ RTA/Depository Participants	DP e-v pro

gin through CDSL Easi/ Easiest facility NSDL IDeAS facility or by logging in rough the Depository Participant gin through e-voting website ww.evotingindia.com using their igin through e-voting website ww.evotingindia.com using their ID/Client ID or Folio No. alongwith voting code/sequence number as ovided by the Company/RTA or areholder may contact the Company/

Members whose email addresses are not registered with the Company's RTA/Depositories, may generate login credentials by following instructions given in the Notes section to Notice of the AGM. The same login credentials may also be used by the members for attending the AGM through VC/OAVM.

RTA, for the same.

The members whose email id/mobile no. is not registered or is not updated may register/update their email id/mobile no. in the following manner:

 a) Members holding shares in physical mode and who have not registered/updated their email addresses/mobile nos. with the Company/ RTA are requested to register/update the same by writing to the Company/ RTA with details of folio number and attaching a self-attested copy of the PAN Card at secretarial@sparcmail.com or to the Company's RTA at ) Members holding shares in dematerialized mode are requested to register/update

their email addresses/ mobile nos. with the Depository Participant(s) with whom they maintain their demat account(s).

Only a person whose name is recorded in the Register of members or in the Register of beneficial owners maintained by the Depositories as on the cut-off date i.e. Wednesday, September 22, 2021, shall be entitled to avail facility of remote evoting/voting during the AGM through electronic voting system. The members who have cast their vote by remote e-voting prior to the meeting will be able to join the meeting but shall not be entitled to cast their vote again

Any person who becomes a member of the Company after sending of the Notice and holds shares of the Company as on the cut-off date i.e. Wednesday, September 22, 2021, and whose PAN is not registered with the Company may obtain the e-voting code for the purpose of e-voting by writing to the RTA /Company at rnt.helpdesk@linkintime.co.in/secretarial@sparcmail.com. In case of any queries or issues regarding attending AGM or e-voting, members may

write an email to helpdesk.evoting@cdslindia.com or contact 022- 23058738 or 022-23058543 or 022-23058542. In case of any grievances pertaining to remote e-voting, the members/beneficial owners may write to Mr. Rakesh Dalvi, Manager - CDSL, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mills Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400 013, Maharashtra, India or send an e-mail on helpdesk.evoting@cdslindia.com or may call on 022-23058542/43. Notice is also hereby given pursuant to Section 91 of the Act and Regulation 42 of the

Listing Regulations that the Register of members and the share transfer books of the Company shall remain closed from Thursday, September 23, 2021 upto the date of the AGM of the Company to be held on Wednesday, September 29, 2021 (both days inclusive) for the purpose of the AGM.

> By order of the Board of Directors For Sun Pharma Advanced Research Company Limited Place: Hyderabad Dinesh Lahoti

> > Company Secretary and Compliance Officer



RCI INDUSTRIES & TECHNOLOGIES LIMITED

Regd. Office: Unit No. 421, 4th Floor, Pearl Omaxe, Netaji Subhash Place, Pitampura, Delhi-110034

Tel:+91 11 41681828 +91 11 27371334 Web: www.rciind.com, Email: compliance@rciind.com CIN: L74900DL1992PLC047055

NOTICE OF THE 30THANNUAL GENERAL MEETING (AGM), E-VOTING INFORMATION& BOOK CLOSURE

Notice is hereby given that the 30" Annual General Meeting ("AGM") of the Company will be held through through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") on Thursday, 30th September, 2021 at 10.30 a.m. (IST) to transact the business, as set out in the Notice of the 30" AGM In accordance with the applicable provisions of Companies Act, 2013 and Rules made

thereunder and the Securities and Exchange Board of India (Listing Obligation and Disclosure Requirement) Regulation, 2015, read with General Circular No. 14/2020 17/2020, 20/2020, 02/2021 dated 08" April, 2020, 13" April, 2020, 05" May, 2020 and 13" January, 2021 respectively and other applicable circulars issued by Ministry of Corporate Affairs (MCA) and SEBI Circular no. SEBI/HO/CFD/CMD1/CIRP/P/2020/79 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 12" May, 2020 and 15" January, 2021. respectively, the Notice of 30" AGM and Annual Report have been sent in electronic mode only to the members whose e-mail addresses are registered with the company/the depository participants. The requirement of sending physical copy of the Notice of AGM and Annual Report to the members have been dispensed with vide MCA Circulars and SEBI Circulars. The electronic dispatch of Annual Report to the Members has been completed on 03° September, 2021. The aforesaid Notice and Annual Report are available on the website of the Company i.e. www.rciind.com and website of the stock exchange i.e. In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule

to time and Regulation 44 of SEB! (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standards on General Meeting (SS-2), the Company is pleased to provide remote @-voting facility to its members, to vote from a place other than venue of AGM through VC/OWVAM facility and e-voting during the AGM through National Securities Depository Limited (NSDL). The procedure/instructions in this respect-have been provided in notes to the Notice of AGM. The members of the Company holding shares eitherin physical form or in dematerialized form, as on cut-off date i.e. 23rdSeptember 2021, shall be eligible to cast vote by remote evoting or attend the meeting through VG/OAVM and cast vote at AGM. The voting rights of members shall be in proportion to their shares of the paid up equity share capital of the

20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended from time

Company as on the Cut-off Date, The remote e-voting period shall commence on Monday 27" September 2021 (09.00 A.M. IST) and end on Wednesday 29" September, 2021 (05.00 P.M. IST). The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. Once the vote ona resolution is cast by the members through remote e-voting, he shall not be permitted to change it subsequently. Members who have cast their votes through remote evoting prior to AGM may also attend the AGM but shall not be entitled for cast their votes again. Any person, who acquires shares and become member of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date i.e. Thursday, 23 September 2021 may obtain the login ID and password by sending a request at evoting@insdl.co.in. However, i you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID-and password for casting your vote.

Mr. Gauray Shah, Company Secretary (Membership No. FCS: 46647), Practicing Company Secretary has been appointed as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.

Members who would like to express their views or ask questions during the AGM may register themselves by sending request mentioning their name, demat account/folio number, email id, mobile number through their registered e-mail to the Company at compliance@rciind.comon or before 23" September, 2021 along with the copy of signed request letter mentioning the name and address of the shareholders, self-attested copy of PAN/other identity and address proof

Shareholders holding shares in dematerialized mode are requested to register update their email addresses with their Depository Participants.

In case of any queries relating to e-voting or attending AGM through VC/OAVM, members may refer the Frequently Asked Questions (FAQs) for the Shareholders and e-voting use nanual for Shareholders available at the download section of www.evoting.nsdlcom or call on toll free no: 1800-1020-990 or 1800-224-430 or send a request at evoting@nsdl.co.in or contact National Securities Depository Limited, Trade World, A Wing; 4" Floor, Kamala Mill Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai-400013, at the designated email For RCI Industries and Technologies Limited

Jyoti Sharma

Place: New Delhi Date: 03" September, 2021 (Company Secretary)

> Registered Office: Survey No. 250-252, Turkapally Village, Shameerpet Mandal, Hyderabad – 500 078, Telangana State

ZENOTECH LABORATORIES LTD CIN: L27100TG1989PLC010122

Email: info@zenotech.co.in NOTICE OF 32nd ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE INFORMATION

Phone No.+91-90320 44584/585/586 Website: www.zenotechlab.com

NOTICE is hereby given that the 32nd Annual General Meeting (AGM) of the Members of Zenotech Laboratories Limited ("the Company") will be held on Saturday, September 25, 2021 at 10:30 a.m. IST through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") without the physical presence of the members at a common venue, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2013 ("Listing Regulations"), read with General Circular No.14/2020 dated April 08, 2020 General Circular No.17/2020 dated April 13, 2020, General Circular No.20/2020 dated May 5, 2020 and General Circular No.2/2021 dated January 13, 2021 issued by Ministry of Corporate Affairs (" MCA") and Securities and Exchange Board of India ("SEBI") (collectively referred to as "relevant circulars"), to transact the business set out in the Notice calling the AGM. Members will be able to attend the AGM through VC / OAVM. Members participating through the VC/OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.

As per our advertisement published on Wednesday, September 1, 2021, the electronic copy of the Annual report for the financial year 2020-21 which inter-alia includes the Notice of the AGM, has been emailed to all the members whose email addresses are registered with the Company's Registrar and Share Transfer Agent, KFin Technologies Private Limited ("RTA")/ Depositories, in accordance with the relevant circulars. The said Annual Report (including Notice of AGM) is also available on website of the Company at www.zenotechlab.com and on the website of BSE Limited a www.bseindia.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com, being the agency appointed by the Company fo providing e-voting and VC/OAVM facility for the AGM. Members can attend and participate in AGM through the VC/OAVM facility only.

The Company is pleased to provide facility to its members, to cast their vote electronically ("remote e-voting") on the businesses as set forth in the Notice of the AGM. The remote e-voting period shall commence on Wednesday, September 22, 2021 from 09:00 a.m. and shall end on Friday, September 24, 2021 till 05:00 p.m. During this period, shareholders of the Company may cast their e-vote remotel by logging on the website at www.evoting.nsdl.com. The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. The members who could not cas their vote by remote e-voting may also be able to cast their votes using an electronic voting system during the AGM. Detailed procedure for remote e-voting and e-voting during the AGM has been provided in the Notice of the AGM. The login credentials for casting votes through e-voting shall be made available to the members through email whose email IDs are registered with RTA/ Depositories. Members who do no receive email or whose email addresses are not registered with the Company's RTA / Depositories, may generate login credentials by following instructions given in the Notes section to Notice of the AGM. The same login credentials may also be used by the members for attending the AGM through VC/ OAVM. Members whose email addresses are not registered with the Company's RTA

Depositories, may generate login credentials by following instructions given in the Notes section to Notice of the AGM. The same login credentials may also be used by the members for attending the AGM through VC/OAVM.

The members whose email id/mobile no. is not registered or is not updated may register/update their email id/mobile no. in the following manner:

a) Members holding shares in physical mode and who have not registered / updated their email addresses/mobile nos, with the Company/ RTA are requested to register/update the same by writing to the Company/ RTA with details of folio number and attaching a self-attested copy of the PAN Card at abdul.gafoor@zenotech.co.in or to the Company's RTA at einward.ris@kfintech.com.

b) Members holding shares in dematerialized mode are requested to register/ update their email addresses/mobile nos. with the Depositories Participants(s) with whom they maintain their demat account(s).

beneficial owners maintained by the Depositories as on the cut-off date i.e. Saturday September 18, 2021 only shall be entitled to avail facility of remote e-voting/ voting during the Meeting through electronic voting system. The Members who have cast their vote by remote e-voting prior to the meeting will be able to join the meeting but shall not be entitled to cast their vote again. Any person holding shares in physical form and non-individual shareholders, who

A person whose name is recorded in the Register of Members or in the Register of

acquires shares of the Company and becomes member of the Company after the notice is send through e-mail and holding shares as of the cut-off date i.e. September 18, 2021, may obtain the login ID and password by sending a request a evoting@nsdl.co.in or Company/RTA. However, if you are already registered with NSDL for remote e-voting, then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot User Details/Password" or "Physical User Reset Password" option available on www.evoting.nsdl.com or call on toll free no. 1800 1020 990 and 1800 22 44 30 In case of Individual Shareholders holding securities in demat mode who acquires shares of the Company and becomes a Member of the Company after sending of the Notice and holding shares as of the cut-off date i.e. September 18, 2021 may follow steps mentioned in the Notice of the AGM". Detailed procedure for e-voting is provided in the Notice of Meeting. In case of any

user manual for Shareholders available at the download section of https:/ www.evoting.nsdl.com/ or call on toll free no.:1800 1020 990/1800 224430 or send a request at evoting@nsdl.co.in. In case of any grievances connected with facility fo remote e-voting or e-voting at the AGM, please contact Ms. Pallavi Mhatre, Manager NSDL or send an email on evoting@nsdl.co.in NOTICE is also hereby given pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 and Rules made thereunder, that the Register of Members and

queries relating to e-voting you may refer to the FAQs for Shareholders and e-voting

Share Transfer Books of the Company shall remain closed from Saturday, September 18, 2021 to Saturday, September 25, 2021 (both days inclusive) for the purpose of 32nd AGM of the Company. The Board of Directors of the Company has appointed Mr. Mahadev Tirunagari Practicing Company Secretary as Scrutinizer to scrutinize the voting process (both

remote e-voting and e-voting during the AGM) in a fair and transparent manner. On behalf of the Board of Directors For Zenotech Laboratories Limited

Date: September 3, 2021

**Abdul Gafoor Mohammad** Company Secretary & Compliance Officer Namokar Trade (India) Limited

Registered Office: Diamond Arcade, 5th - FR. FL - 504 68, Jessore Road, Kolkata – 700055 CIN:L51909WB1985PLC038407

Phone: +91-33-3297-7609; E-mail: ratan.namokar@gmail.com; Website:www.namokartrade.com NOTICE IS HEREBY GIVEN that the 40th Annual General Meeting (AGM) of the Company will be held on Wednesday, September 29, 2021, at 11:00 a.m. at Diamond Arcade, 5th Floor, FL-504, 68, Jessore Road, Kolkata - 700055, to transact the business as mentioned in the Notice of AGM sent along with the Audited Financial Statements of the Company for the year ended March 31, 2021, and the Board's Report and Auditors Report thereon.

Dispatch of the Annual Report, 2021, along with the AGM Notice, Attendance Slip and Proxy Form, has been completed on September 3, 2021. The Notice of AGM is also available on the website of National Securities Depository Limited (NSDL), i.e. https://www.evoting.nsdl.com Notice is further given that the Company is providing electronic voting facility from a place other than the venue of AGM ('remote e-voting') to the members to exercise their votes on all the resolutions set forth in the Notice of AGM. The company has engaged NSDL for providing evoting facility. The details of remote e-voting are given below: I) The remote e-voting will commence on Sunday, September 26, 2021 from 9.00 a.m.

and ends on Thursday, September 28, 2021 till 5.00 PM. The e-voting module shall be disabled for voting thereafter, and no one shall be allowed to vote electronically after September 28, 2021 (5:00 PM). (ii) The voting rights of Members shall be in proportion to their share of the paid-up

share capital of the Company as on the cut-off date i.e. September 22, 2021. (iii) Notice of AGM has been sent to all the members whose names appeared in the

Register of Members/Beneficial Owners as on September 1, 2021. Any person who acquires equity shares of the Company and becomes a Member after September 1 2021, and holding shares as on the cut-off date i.e. September 22, 2021, may obtain the Login ID and Password by sending a request at ratan.namokar@gmail.com, or call at Tel: +91-33-3297-7609.

(iv) Once a vote is cast by the Member, he shall not be allowed to change it

(v) The facility of casting vote through ballot paper will be made available at the AGM and the eligible members attending the AGM shall be able to cast their vote at AGM through ballot paper.

(vi) The Members who cast their vote by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote again. In case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asked

Questions (FAQs) and e-voting user manual for members available at the Downloads section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or contact Mr. Amit Vishal, Senior Manager, National Securities Depository Ltd., Trade World, 'A' Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Pare!, Mumbai —400 013, at the designated email IDs: evoting@nsdl.co.in or amitv@nsdl.co.in or at telephone nos. +91 22 2499 4600/ +91 22 NOTICE IS ALSO HEREBY GIVEN that pursuant to Section 91 of the Companies

Act, 2013, that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Thursday, September 23, 2021 to Wednesday, September 29, 2021 (both days inclusive).

By Order of the Board of Directors For Namokar Trade (India) Limited Ratan Lal Baid

**Managing Director** 

DIN: 07060481

Place: Kolkata Date: 03-09-2021

> WILLIAMSON MAGOR & CO. LIMITED Corporate Identity Number (CIN): L01132WB1949PLC017715

REGISTERED OFFICE: FOUR MANGOE LANE, SURENDRA MOHAN

GHOSH SARANI, KOLKATA-700001 TELEPHONE: 033-2210-1221, 2248-9434, 2248-9435 FAX: 91-33-2248-3683/8114/6265 E-mail: administrator@mcleodrussel.com, Website: www.wmtea.com **NOTICE TO MEMBERS - 70TH ANNUAL** 

**GENERAL MEETING AND E-VOTING** 

Notice is hereby given that 70th Annual General Meeting ("AGM") of the members of the Company will be held on Tuesday, 28th September, 2021 at 3:00 P.M. (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OVAM") to transact the business as set out in the Notice dated 12th August, 2021.

The Notice convening AGM and the Annual Report of the Company

has been sent through electronic mode on 2nd September, 2021 to all the members whose e-mail addresses are registered with the Company's Registrar and Share Transfer Agent/Depository Participant(s), in accordance with the MCA Circular Nos. 14/2020, 17/2020 and 20/2020 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020 and January 13, 2021, respectively (collectively referred to as "MCA Circulars") and SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 issued by the Securities and Exchange Board of India. The Notice and Annual Report for the Financial Year 2020-21 are available & can be downloaded from the website of the Company viz., www.wmtea.com and also on the website of Stock Exchange where Equity Shares of the Company are listed, viz., www.bseindia.com, www.nseindia.com and www.cse-india.com. The requirements of sending physical copy of Notice and Annual Reports for F.Y 2020-21 to the members have been dispensed with vide MCA and SEBI circulars.

Members are provided with a facility to attend the AGM through electronic platform provided by National Securities Depository Limited (NSDL). Members may access the platform to attend the AGM through VC/OAVM at http://www.evoting.nsdl.com under the Shareholder/members login by using the remote e-voting credentials. The link for VC/OAVM will be available in shareholder/members login where the EVEN of Company will be

Members of the Company be and are hereby informed that pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended the members are provided with the facility to cast their vote on all the resolutions set forth in the Notice using electronic voting system. (e-voting) provided by NSDL. The detailed e-voting instructions

 (a) Date and time of commencement of remote e-voting: Friday, 24th September, 2021 at 9.00 a.m. (IST).

(b) Date and time of end of remote e-voting: Monday, 27th September, 2021 at 5.00 p.m. (IST).

(c) Cut-off date: Tuesday, 21st September, 2021.

are as enumerated below:-

(d) The voting rights of the members shall be in proportion to the number of equity shares held by them as on the Cut-off date i.e., Tuesday, 21st September, 2021.

voting module shall be disabled by the NSDL after aforesaid (f) Those Members who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions

(e) Remote e-voting by electronic mode shall not be allowed

beyond 5.00 p.m. on 27th September, 2021. The remote e-

through remote e-voting, shall be eligible to vote through e-

voting during the AGM. (g) Notice of Annual General Meeting inter alia containing the procedures of remote e-voting, e-voting during the AGM & attending the AGM through VC/OAVM are available on the web site of the Company at www.wmtea.com and on the

website of NSDL at www.evoting.nsdl.com. (h) Members who have acquired shares after the despatch of the Notice of AGM and before the cut-off date may approach the NSDL/ Company for issuance of the User ID and Password

for exercising their right to vote by electronic means. A member may participate in the AGM through VC/OAVM. even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to cast their votes again.

(j) A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial owners maintained by Depositories as on the cut-off date only shall be entitled to avail facility of remote e voting or e-voting during the AGM.

Members holding shares in physical form, whose e-mail addresses

are not registered with the Company, may register their e-mail

address by sending the scanned copy of signed request letter mentioning their name, folio number, number of shares held and complete postal address, self-attested copy of the PAN Card along with self-attested copy of any document (such as Aadhar Card/Driving License/Voter ID Card/Passport/latest Electricity Bill/ latest Telephone/Mobile Bill/Bank Passbook particulars) to the Company at aditi.dhanuka@mcleodrussel.com or to the RTA, i.e. Maheshwari Datamatics Private Limited at mdpldc@yahoo.com. Members holding shares in demat form can register/update their e-mail address with their Depository Participants.

Secretary (Membership No. FCS 4848 / C.P. No. 3238) as Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner. In case of any queries you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no. 1800-222-990 or send a request to Ms. Pallavi Mhatra, Manager, NSDL, 4th Floor, 'A' Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai-400013; Email: evoting.nsdl.co.in/pallavid@nsdl.co.in; Telephone nos. +91-22-2499 4545/1800-222-990.

Place: Kolkata

Date: 03.09.2021

The Company has appointed Mr. A K Labh, a Practicing Company

By Order of the Board Williamson Magor & Co. Limited Aditi Daga Company Secretary

financialexp.epapr.in

(Dr. Khalid Iqbal Khan) Place: Gurugram Whole-time Director-Legal & Company Secretary Dated: 03.09.2021

ReLI∆NCe

Date: September 03, 2021

Place: Mumbai

CAPITAL

NOTICE

Sub.: Transfer of Equity Shares and Dividend of the Company to Investor Education and Protection Fund Authority

years shall be liable to be transferred to Investor Education and Protection Fund (IEPF) Authority, on or after October 29, 2021.

Shareholders are requested to claim their share(s) and unpaid / unclaimed dividend(s),

Shareholders may note that both the Unclaimed dividend and the share(s) transferred

For Reliance Capital Limited

Atul Tandon Company Secretary & Compliance Officer

**RELIANCE** 

The details of shares and dividend liable to be transferred to IEPF Authority are placed

Shareholders are requested to claim their share(s) and unpaid / unclaimed dividend, as

For Reliance Infrastructure Limited Paresh Rathod



**AEGIS LOGISTICS LIMITED** Regd. Office: 502 Skylon, G.I.D.C., Char Rasta, Vapi 396 195, Dist. Valsad, Gujarat Corp. Office: 1202, Tower B, Peninsula Business Park, G. K. Marg, Lower Parel (W), Mumbai - 400013 Tel.: +91 22 6666 3666 Fax: +91 22 6666 3777

E-mail: aegis@aegisindia.com Website: www.aegisindia.com NOTICE OF RECORD DATE FOR FINAL DIVIDEND AND UPDATION OF SHAREHOLDER DETAILS NOTICE is hereby given that pursuant to the applicable provisions of the Companies Act, 2013 and Rules made thereunder, the 64th Annual General Meeting ("AGM") of Aegis Logistics Limited will be held on Thursday, October 21, 2021 at 5:00 p.m. (IST) through Video Conference ("VC") or Other Audio Visua

Further, Kindly note that dividend as recommended by the Board of Directors of the Company at their Meeting held on May 27, 2021 @ 200% i.e. Rs. 2.00 per share (face value of Re.1 each), if declared by the members at the ensuing Annual General Meeting will be paid to those eligible members whose name appear on the Registrar of Members as on the Record Date i.e. Friday, September 17, 2021.

Kindly note that the said dividend, will be paid on or before Thursday. November 18, 2021 if declared by the Members, at the ensuing Annual General Meeting. Further it is hereby given that pursuant to the SEBI Circular SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, the Company is providing the simple and error free facility through web-portal for

registration of e-mail ID along with bank details for the shareholders holding shares in physical form. The Shareholders holding shares in physical form and who have still not registered their e-mail ID, PAN along with bank details with the Company can get their e-mail IDs, PAN and Bank details registered with the Company's Registrar & Share Transfer Agent, Link Intime India Pvt. Ltd. ("Link Intime"), by browsing the link: https://linkintime.co.in/emailreg/email\_register.html and by following the registration process as guided thereafter, on or before Friday, September 17, 2021 (Record date for determining entitlement of members eligible to receive dividend for the Financial year 2020-2021) so as to receive the Annual Report for the financial year 2020-21 and e-voting details on e-mail and to receive the dividend electronically in

your bank account registered with link Intime. The Shareholders holding shares in demat form are advised to keep their e-mail ID, PAN and Bank details updated with their depository participant on or before Friday, September 17, 2021 (Record date fo determining entitlement of members eligible to receive dividend for the Financial year 2020-2021)to receive the Annual Report of the Company and e-voting details on e-mail and to receive the dividence electronically in your bank account.

For Aegis Logistics Ltd.

Place: Mumbai Date: September 3, 2021

Monica Gandhi Company Secretary

#### B.C. POWER CONTROLS LIMITED (CIN: L31300DL2008PLC179414)

Registered Office: 7A/39, WEA Channa Market, Karol Bagh, New Delhi-110005 Email: info@bonlongroup.com, Website: www.bcpowercontrols.com Phone: 011-47532795, Fax: 011-47532798

Notice - 13"Annual General Meeting This is to inform that, the 13" Annual General Meeting ("AGM") of B.C. Power Controls Limited ("the Company") will be held on Tuesday, 28" September, 2021 at 01:00P.M., through video conferencing (VC)/ other audio visual means (OAVM) in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the rules made there under, read with Ministry of Corporate Affairs (MCA) Circular 14/2020, 17/2020, 20/2020 and 02/2021 dated 8" April 2020, 13" April, 2020, 5" May 2020 and 13" January 2021 respectively issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circular Nos. SEBI/HO/CFD/CIR/P/2020/79 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 12" May 2020 and 15" January 2021 respectively issued by the SEBI, to transact the business as set out in the notice of AGM which will be sent in due course of time.

Members may note that, in view of the continuing COVID-19 pandemic the AGM will be held through VC/OAVM in compliance with the above stated circulars and in furtherance of Go-Green initiative of the government, the Notice of the 13" AGM and Annual Report for the financial year 2020-21, will be sent through electronic mode only to those members whose email addresses are registered with the Company / Depository Participant/ Registrar and Transfer Agent ("RTA"). The members attending the meeting through VC or OAVM shall be counted for the purpose of quorum under section 103 of the Act. The Company is also providing e-voting and remote e-voting facility to all its members similar to earlier practices. The e-copy of the notice of the 13"AGM along with the Annual Report for the FY 2020-21 of the Company will be available on the website of the Company at www.bcpowercontrols.com and also be available on the website of the BSE Limited at www.bseindia.com . in due course of time.

The Members can attend and participate in the AGM through VC/OAVM only. Detailed instructions for joining the AGM will be provided in the Notice of the 13"AGM. Accordingly, please note that no provision has been made to attend and participate in the AGM of the Company in person, to ensure compliance with the directives issued by the government authorities with respect to Covid-19 pandemic.

In case the email address is not registered with the Company / Depository Participant, please follow the process of registering the same as mentioned below:

Physical 100% Shareholding of the Company is in De-mat Form, so this provision is not Holding applicable to the Company.

Demat Please contact your Depositary Participant (DP) and register your email Holding address as per the process advised by DP or get temporarily registered with RTA of the Company Bigshare Services Private Limited, by clicking the link: www.bigshareonline.com/ForInvestor.aspx.

Please also update your bank detail with your DP for dividend payment by NACH if declare by company

Members may also note that if your e-mail id is registered with the Company/Depository Participant, the login credentials for remote e-voting / e-voting during the AGM will be sent. on the registered e-mail address along with the notice of the 13"AGM. However, members who have not registered their email-id can follow the procedure for registering e-mail id as mentioned above. Members may note that the detailed procedure for remote e-voting / evoting during the AGM is also mentioned in the notice of AGM.

The above information is being issued for the information and benefit of all the members of the Company and is in compliance with the MCA Circular(s) and the SEBI Circular.

Place: New Delhi

Date: 03" September, 2021

Rajbir Sharma (Company Secretary)

For B.C. Power Controls Limited

## FEDERAL-MOGUL GOETZE (INDIA) LIMITED TENNECO CIN: L74899DL1954PLC002452

Registered Office: DLF Prime Towers, 10 Ground Floor, F- 79 & 80, Okhia Phase- I, New Delhi- 110020 Corporate Office: 10" Floor, Paras Twin Towers, Tower- B, Sector- 54, Golf Course Road, Gurugram-12200 Website: www.federalmogulgoetzeindia.net; Tel.: +91 124 4784530; +91 11 49057597, Fax: +91 124 4292840, E-mail: investor.grievance@tenneco.com

# NOTICE

The Notice is hereby given that the 66"Annual General Meeting ("AGM" of FEDERAL-MOGUL GOETZE (INDIA) LIMITED ("the Company") is scheduled to be held on Monday, September 27, 2021 at 11:00 A.M. through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM) in compliance with General Circular Nos. 14/2020 dated 8" April, 2020, 17/2020dated 13th April, 2020, 20/2020 dated 5th may, 2020 and, 02/2021dated 13" January, 2021 and all other applicable laws and circulars issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India (collectively referred to as "MCA Circulars"), and Securities and Exchange Board of India (SEBI)circulars dated 12" May, 2020 and 15" January, 2021 (collectively referred to as "SEBI Circulars") to transact the Ordinary and Special businesses as set out in the Notice calling AGM. Company's Registered Office i.e DLF Prime Towers, 10 Ground Floor, F- 79 & 80, Okhla Phase- I, New Delhi- 110020 will be deemed to be the venue for the AGM.

In compliance with the above said MCA and SEBI circulars, only electronic copies of the Notice of the AGM alongwith the Annual Report for the Financial Year 2020-21have already been emailed to all the shareholders whose email addresses are registered/available with the Company/Registrar and Transfer Agent ("RTA")/Depository Participants ("DP's"). The emailing of all Notices has been completed on 2"

In terms of Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules 2014 Secretarial Standard-2 on General Meetings and Regulation 44 of the SEBI (Listing Obligations & disclosure Requirements) Regulations. 2015, as amended from time to time, the Company is providing facility of voting by electronic means and the businesses set out in Notice of 66"Annual General Meeting, may be transacted through such voting The facility of voting through electronic voting system shall also be made available during the meeting on the day of the AGM for those members who have not already cast their vote by remote e-voting. The Board has appointed Mr. Abhishek Bansal, Advocate as scrutinizer for conducting the voting in a fair and transparent manner.

 Members holding shares either in physical or in dematerialized form as on the cut-off date i.e. 17"September, 2021 may cast their vote electronically on businesses as set out in the notice through such

A person who has acquired shares and become a Member of the Company after the Notice was sent and holding shares as on the cutoff date i.e. 17°September, 2021, may obtain LOGIN ID and PASSWORD by sending a request at evoting@nsdl.co.in or Mr. J K Senior Manager, Alankit Assign Heights 3E/7, Jhandewalan Extension, New Delhi-110055, Tel. No. +91 11 42641234, email: jksingla@alankit.com. However, if you are already registered with NSDL for remote e-voting then members may use their existing user ID and password for casting the vote.

The remote e-voting shall begin on Friday, September 24, 2021 at 09.00 A.M. and end on Sunday, September 26, 2021at 05.00 P.M. The remote E-voting shall not be allowed beyond 05.00 p.m. on Sunday, September 26, 2021.

The facility for voting through electronic voting system shall also be made available at the AGM and the Members participating in the AGM through VC/ OVAM who have not already cast their votes by remote e-voting shall be able to exercise their right in the meeting.

Members whose names are recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote

e-voting or voting at Annual General Meeting. Members may note that notice of the 66"Annual General Meeting and the Annual Report for the FY 2020-21 are also available on Company's website <a href="http://www.federalmogulgoetzeindia">http://www.federalmogulgoetzeindia</a>. net/web/index.html, the website of NSDL www.evoting.nsdl.com as well as on the website of the stock exchange namely NSE & BSE and can be made available for inspection by writing to the Company

at investor.grievance@tenneco.com.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Members and remote e-voting user manual for Members available at the downloads section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990. You may also send your queries/grievance relating to e-voting to Mr. J. K. Singla, Senior Manager, Alankit Assignments Limited, Alankit Heights 3E/7, Jhandewalan Extension New Delhi-110055, Tel. No. +91 11 42641234, email: jksingla@alankit.com.

The register of members and share transfer books of the Company shall remain closed from Monday, 20"September, 2021 to Monday, 27th September, 2021 (both days inclusive) for the purpose of 66th AGM.

For Federal-Mogul Goetze (India) Limited

Place: Gurugram Dated: 03.09.2021

(Dr. Khalid Iqbal Khan) Whole-time Director-Legal & Company Secretary

Place: Mumbai

Date: September 03, 2021

**ReLI**∆NCE

CAPITAL

(for the attention of Equity Shareholders of the Company) Sub.: Transfer of Equity Shares and Dividend of the Company to Investor Education and Protection Fund Authority

NOTICE

NOTICE is hereby given that pursuant to Section 124 of the Companies Act, 2013 and the Investor Education and Protection Fund (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (the Rules), as amended, all the share(s) in respect of which dividend has not been paid or claimed for seven consecutive years or more and the dividend declared for Financial Year 2013-14, which remains unpaid or unclaimed for a period of seven years shall be liable to be transferred to Investor Education and Protection Fund (IEPF) Authority, on or after October 29, 2021.

The details of shares and dividend liable to be transferred to IEPF Authority are placed on website of the Company at www.reliancecapital.co.in, Shareholders may note that the details uploaded by the Company on its website shall be deemed to be adequate notice for the purpose of transfer of shares to IEPF Authority pursuant to the Rules.

Shareholders are requested to claim their share(s) and unpaid / unclaimed dividend(s), as stated above, on or before October 25, 2021, failing which the same shall be transferred to the IEPF Authority without any further notice.

Shareholders may note that both the Unclaimed dividend and the share(s) transferred to IEPF Authority including all benefits accruing on such share(s), if any, can be claimed back by them from IEPF Authority after following the procedure prescribed in the Rules. For any queries on the above matter, shareholders are requested to contact the Company's Registrar and Transfer Agent, KFin Technologies Private Limited Tel.:+91 40 6716 1500 Fax: +91 40 6716 1791, Toll Free No.(India):1800 4250 999, Email: rclinvestor@kfintech.com.

> For Reliance Capital Limited Atul Tandon

Company Secretary & Compliance Officer

Date: September 1, 2021 Reliance Capital Limited

Place: Mumbai

CIN: L65910MH1986PLC165645 Regd. Office: Kamala Mills Compound, Trade World 7th Floor, B Wing, S. B. Marg, Lower Parel, Mumbai 400 013 Tel.: +91 22 4158 4000. Fax: +91 22 2490 5125

E-mail: rcl.investor@relianceada.com, Website:www.reliancecapital.co.in

**RELIANCE** Infrastructure

NOTICE

(for the attention of Equity Shareholders of the Company) Sub.: Transfer of Equity Shares and Dividend of the Company to Investor **Education and Protection Fund Authority** 

NOTICE is hereby given that pursuant to Section 124 of the Companies Act, 2013 and the Investor Education and Protection Fund (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (the Rules), as amended, all the share(s) in respect of which dividend has not been paid or claimed for seven consecutive years or more and the dividend declared for Financial Year 2013-14, which remains unpaid or unclaimed for a period of seven years shall be liable to be transferred to Investor Education and Protection Fund (IEPF) Authority, on or after November 6, 2021.

The details of shares and dividend liable to be transferred to IEPF Authority are placed on website of the Company at www.rinfra.com Shareholders may note that the details uploaded by the Company on its website shall be deemed to be adequate notice for the purpose of transfer of shares to IEPF Authority pursuant to the Rules.

Shareholders are requested to claim their share(s) and unpaid / unclaimed dividend, as stated above, on or before November 2, 2021, failing which the same shall be transferred to the IEPF Authority without any further notice.

Shareholders may note that both the Unclaimed dividend and the share(s) transferred to IEPF Authority including all benefits accruing on such share(s), if any, can be claimed back by them from IEPF Authority after following the procedure prescribed in the Rules. For any queries on the above matter, shareholders are requested to contact the Company's Registrar and Transfer Agent, KFin Technologies Private Limited Tel.:+91 40 6716 1500 Fax: +91 40 6716 1791, Toll Free No.(India):1800 309 4001, Email: rinfra.investor@relianceada.com.

For Reliance Infrastructure Limited Paresh Rathod Company Secretary & Compliance Officer

Place: Mumbai Date: September 1, 2021 Reliance Infrastructure Limited CIN: L75100MH1929PLC001530 Regd. Office: Reliance Centre, Ground Floor 19, Walchand Hirachand Marg, Ballard Estate, Mumbai 400001

Tel.: +91 22 4303 1000, Fax: +91 22 4303 4662

sparco Sun Pharma Advanced Research Company Limited

E-mail:rinfra.investor@relianceada.com, Website:www.rinfra.com

# Registered Office: Plot No. 5&6/1, Savli G.I.D.C. Estate, Savli - Vadodara

Highway, Manjusar - 391775 Vadodara, Gujarat. Tel: +91 02667 666800; Corporate Office: 17/B, Mahal Industrial Estate, Mahakali Caves Road, Andheri East, Mumbai 400 093, Maharashtra. Tel: +91 22 6645 5645 Fax: +91 22 6645 5685 CIN; L73100GJ2006PLC047837 Website: www.sparc.life Email: secretarial@sparcmail.com

## NOTICE OF ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE NOTICE is hereby given that the Sixteenth Annual General Meeting ("AGM") of the

members of the Sun Pharma Advanced Research Company Limited ("Company") will be held on Wednesday, September 29, 2021 at 5:00 p.m. IST through Video Conferencing ("VC")/ Other Audio-Visual Means ("OAVM") without the physical presence of the members at a common venue, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 ("Act") and the rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), read with General Circular No. 14/2020 dated April 08, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 20/2020 dated May 05, 2020, and General Circular No. 02/2021 dated January 13, 2021 and other applicable circulars ("MCA Circulars") issued by the Ministry of Corporate Affairs ("MCA") and circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/ 2020/79 dated May 12, 2020 read with Circular No. SEBI/HO/CFD/CMD2/ CIR/P/2021/11 dated January 15, 2021 and other applicable circulars, if any, ("SEBI Circulars") issued by Securities and Exchange Board of India ("SEBI") (MCA Circulars and SEBI Circulars collectively referred to as "relevant circulars"), to transact the businesses set out in the Notice convening the AGM. Members participating through the VC/OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103

The electronic copy of the Annual Report for the financial year 2020-21 along with the Notice of the AGM, will be emailed to all the members whose email addresses are registered with the Company's Registrar and Share Transfer Agent, Link Intime India Private Limited ("RTA")//Depositories, in accordance with the relevant circulars. The said Annual Report and Notice of the AGM shall also be made available on the website of the Company at www.sparc.life and on the websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of the Central Depository Services (India) Limited ("CDSL") at www.evotingindia.com, being the agency appointed by the Company for providing e-voting and VC/OAVM facility for the AGM. Members can attend and participate in AGM through the VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in Notice of the AGM. Members are requested to carefully read all the instructions detailed in the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting and

The Company is pleased to provide facility to its members, to cast their vote electronically ("remote e-voting") on the businesses as set forth in the Notice of the AGM. The remote e-voting period shall commence on Sunday, September 26, 2021 at 09:00 A.M. and ends on Tuesday, September 28, 2021 at 05:00 P.M. During this period, the members may cast their e-vote remotely by logging in as per login method rovided below. The remote e-voting module shall be disabled by CDSL for voting thereafter. Pursuant to requirement of SEBI the e-voting is enabled for the demat account holders, by way of a single login credential, through their demat accounts/websites of Depositories/Depository Participants. The shareholders can login for e-voting during the AGM and join the AGM by VC/OAVM, in the same manner as given below. Detailed instructions/procedure for remote e-voting, e-voting during

e AGM and joining AGM by VC/OAVM are provided in the Notice of the AGM Login method for remote e-voting/e-voting during the AGM and joining AGM

Individual shareholders holding shares

Shareholders holding shares in Physical and Non-Individual Shareholders

holding shares in demat. Shareholders holding shares in Physical and Non-Individual Shareholders holding shares in demat who have not updated their PAN with the Company/ RTA/Depository Participants

Login through CDSL Easi/ Easiest facility or NSDL IDeAS facility or by logging in through the Depository Participant. Login through e-voting website www.evotingindia.com using their DPID/Client ID or Folio No. Login through e-voting website www.evotingindia.com using their DPID/Client ID or Folio No. alongwith e-voting code/sequence number as

provided by the Company/RTA or

RTA, for the same.

shareholder may contact the Company/

Members whose email addresses are not registered with the Company's RTA/Depositories, may generate login credentials by following instructions given in the Notes section to Notice of the AGM. The same login credentials may also be used by the members for attending the AGM through VC/OAVM.

The members whose email id/mobile no. is not registered or is not updated may register/update their email id/mobile no. in the following manner:

a) Members holding shares in physical mode and who have not registered/updated their email addresses/mobile nos. with the Company/ RTA are requested to register/update the same by writing to the Company/ RTA with details of folio number and attaching a self-attested copy of the PAN Card at secretarial@sparcmail.com or to the Company's RTA at rnt.helpdesk@linkintime.co.in.

Members holding shares in dematerialized mode are requested to register/update their email addresses/ mobile nos. with the Depository Participant(s) with whom they maintain their demat account(s).

Only a person whose name is recorded in the Register of members or in the Register of beneficial owners maintained by the Depositories as on the cut-off date i.e. Wednesday, September 22, 2021, shall be entitled to avail facility of remote evoting/voting during the AGM through electronic voting system. The members who have cast their vote by remote e-voting prior to the meeting will be able to join the neeting but shall not be entitled to cast their vote again Any person who becomes a member of the Company after sending of the Notice and

holds shares of the Company as on the cut-off date i.e. Wednesday, September 22, 2021, and whose PAN is not registered with the Company may obtain the e-voting code for the purpose of e-voting by writing to the RTA /Company at rnt.helpdesk@linkintime.co.in/secretarial@sparcmail.com . In case of any queries or issues regarding attending AGM or e-voting, members may

write an email to helpdesk.evoting@cdslindia.com or contact 022- 23058738 or 022-23058543 or 022-23058542. In case of any grievances pertaining to remote e-voting, the members/beneficial owners may write to Mr. Rakesh Dalvi, Manager – CDSL, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mills Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400 013, Maharashtra, India or send an e-mail on helpdesk.evoting@cdslindia.com or may call on 022-23058542/43. Notice is also hereby given pursuant to Section 91 of the Act and Regulation 42 of the

Listing Regulations that the Register of members and the share transfer books of the Company shall remain closed from Thursday, September 23, 2021 upto the date of the AGM of the Company to be held on Wednesday, September 29, 2021 (both days inclusive) for the purpose of the AGM.

> By order of the Board of Directors For Sun Pharma Advanced Research Company Limited Dinesh Lahoti

Company Secretary and Compliance Officer



# RCI INDUSTRIES & TECHNOLOGIES LIMITED

Regd. Office: Unit No. 421, 4" Floor, Pearl Omaxe, Netaji Subhash Place, Pitampura, Delhi-110034 Tel:+91 11 41681828 +91 11 27371334 Web: www.rciind.com, Email: compliance@rciind.com CIN: L74900DL1992PLC047055 NOTICE OF THE 30THANNUAL GENERAL MEETING (AGM),

E-VOTING INFORMATION& BOOK CLOSURE Notice is hereby given that the 30" Annual General Meeting ("AGM") of the Company will be held through through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") on Thursday, 30" September, 2021 at 10.30 a.m. (IST) to transact the business, as set out in the Notice of the 30" AGM.

In accordance with the applicable provisions of Companies Act, 2013 and Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligation and Disclosure Requirement) Regulation, 2015, read with General Circular No. 14/2020, 17/2020, 20/2020, 02/2021 dated 08" April, 2020, 13" April, 2020, 05" May, 2020 and 13" January, 2021 respectively and other applicable circulars issued by Ministry of Corporate Affairs (MCA) and SEBI Circular no. SEBI/HO/CFD/CMD1/CIRP/P/2020/79 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 12" May, 2020 and 15" January, 2021. respectively, the Notice of 30th AGM and Annual Report have been sent in electronic mode. only to the members whose e-mail addresses are registered with the company/the depository participants. The requirement of sending physical copy of the Notice of AGM and Annual Report to the members have been dispensed with vide MCA Circulars and SEBI Circulars. The electronic dispatch of Annual Report to the Members has been completed on 103" September, 2021. The aforesaid Notice and Annual Report are available on the website of the Company i.e. www.rciind.com and website of the stock exchange i.e. www.bseindia.com.

In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended from time to time and Regulation 44 of SEB! (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standards on General Meeting (SS-2), the Company is pleased to provide remote Q-voting facility to its members, to vote from a place other than venue of AGM through VC/OWVAM facility and e-voting during the AGM through National Securities Depository Limited (NSDL). The procedure/instructions in this respect-have been provided in notes to the Notice of AGM.

The members of the Company holding shares eitherin physical form or in dematerialized form, as on cut-off date i.e. 23rdSeptember 2021, shall be eligible to cast vote by remote evoting or attend the meeting through VG/OAVM and cast vote at AGM. The voting rights of members shall be in proportion to their shares of the paid up equity share capital of the Company as on the Cut-off Date, The remote e-voting period shall commence on Monday 27" September 2021 (09.00 A.M. IST) and end on Wednesday 29" September, 2021 (05.00 P.M. IST). The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. Once the vote ona resolution is cast by the members through remote e-voting, he shall not be permitted to change it subsequently. Members who have cast their votes through remote evoting prior to AGM may also attend the AGM but shall not be entitled for cast their votes again. Any person, who acquires shares and become member of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date i.e. Thursday, 23 September 2021 may obtain the login ID and password by sending a request at evoting@insdl.co.in. However, it you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID-and password for casting your vote.

Mr. Gauray Shah, Company Secretary (Membership No. FCS: 46647), Practicing Company Secretary has been appointed as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.

Members who would like to express their views or ask questions during the AGM may register themselves by sending request mentioning their name, demat account/folio number, email id, mobile number through their registered e-mail to the Company at compliance@rciind.comon or before 23" September, 2021 along with the copy of signed request letter mentioning the name and address of the shareholders, self-attested copy of PAN/other identity and address proof.

Shareholders holding shares in dematerialized mode are requested to register update their email addresses with their Depository Participants.

In case of any queries relating to e-voting or attending AGM through VC/OAVM, members may refer the Frequently Asked Questions (FAQs) for the Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdlcom or call on toll free no: 1800-1020-990 or 1800-224-430 or send a request at evoting@nsdl.co.in or contact National Securities Depository Limited, Trade World, A Wing; 4° Floor, Kamala Mill Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai-400013, at the designated email id:-evoting@nsdi.co.in

For RCI Industries and Technologies Limited

Place: New Delhi Date: 03<sup>td</sup> September, 2021

Jyoti Sharma (Company Secretary)

# ZENOTECH LABORATORIES LTD

CIN: L27100TG1989PLC010122 Registered Office: Survey No. 250-252, Turkapally Village, Shameerpet Mandal, Hyderabad – 500 078, Telangana State Phone No.+91-90320 44584/585/586 Website: www.zenotechlab.com Email: info@zenotech.co.in

# NOTICE OF 32nd ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE INFORMATION

NOTICE is hereby given that the 32nd Annual General Meeting (AGM) of the Member of Zenotech Laboratories Limited ("the Company")will be held on Saturday, September 25, 2021 at 10:30 a.m. IST through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") without the physical presence of the members at a common venue, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 ("Listing Regulations"), read with General Circular No.14/2020 dated April 08, 2020 General Circular No.17/2020 dated April 13, 2020, General Circular No.20/2020 dated May 5, 2020 and General Circular No.2/2021 dated January 13, 2021 issued by Ministry of Corporate Affairs (" MCA") and Securities and Exchange Board of India ("SEBI") (collectively referred to as "relevant circulars"), to transact the business set out in the Notice calling the AGM. Members will be able to attend the AGM through VC / OAVM. Members participating through the VC/OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.

As per our advertisement published on Wednesday, September 1, 2021, the electronic copy of the Annual report for the financial year 2020-21 which inter-alia includes the Notice of the AGM, has been emailed to all the members whose email addresses are registered with the Company's Registrar and Share Transfer Agent, KFin Technologies Private Limited ("RTA")/ Depositories, in accordance with the relevant circulars. The said Annual Report (including Notice of AGM) is also available on website of the Company at www.zenotechlab.com and on the website of BSE Limited a www.bseindia.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com, being the agency appointed by the Company for providing e-voting and VC/OAVM facility for the AGM. Members can attend and participate in AGM through the VC/OAVM facility only.

The Company is pleased to provide facility to its members, to cast their vote electronically ("remote e-voting") on the businesses as set forth in the Notice of the AGM. The remote e-voting period shall commence on Wednesday, September 22, 2021 from 09:00 a.m. and shall end on Friday, September 24, 2021 till 05:00 p.m. During this period, shareholders of the Company may cast their e-vote remotely by logging on the website at www.evoting.nsdl.com. The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. The members who could not cast their vote by remote e-voting may also be able to cast their votes using an electronic voting system during the AGM. Detailed procedure for remote e-voting and e-voting during the AGM has been provided in the Notice of the AGM. The login credentials for casting votes through e-voting shall be made available to the members through email whose email IDs are registered with RTA/ Depositories. Members who do not receive email or whose email addresses are not registered with the Company's RTA / Depositories, may generate login credentials by following instructions given in the Notes section to Notice of the AGM. The same login credentials may also be used by the members for attending the AGM through VC/ OAVM.

Members whose email addresses are not registered with the Company's RTA/ Depositories, may generate login credentials by following instructions given in the Notes section to Notice of the AGM. The same login credentials may also be used by the members for attending the AGM through VC/OAVM.

The members whose email id/mobile no. is not registered or is not updated may register/update their email id/mobile no. in the following manner:

a) Members holding shares in physical mode and who have not registered / updated their email addresses/mobile nos. with the Company/ RTA are requested to register/update the same by writing to the Company/ RTA with details of folio number and attaching a self-attested copy of the PAN Card a abdul.gafoor@zenotech.co.in or to the Company's RTA einward.ris@kfintech.com.

Members holding shares in dematerialized mode are requested to register/ update their email addresses/mobile nos, with the Depositories Participants(s) with whom they maintain their demat account(s).

A person whose name is recorded in the Register of Members or in the Register of beneficial owners maintained by the Depositories as on the cut-off date i.e. Saturday, September 18, 2021 only shall be entitled to avail facility of remote e-voting/voting during the Meeting through electronic voting system. The Members who have cast their vote by remote e-voting prior to the meeting will be able to join the meeting bu shall not be entitled to cast their vote again.

Any person holding shares in physical form and non-individual shareholders, who acquires shares of the Company and becomes member of the Company after the notice is send through e-mail and holding shares as of the cut-off date i.e. September 18, 2021, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or Company/RTA. However, if you are already registered with NSDL for remote e-voting, then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot User Details/Password" or "Physical User Reset Password" option available on www.evoting.nsdl.com or call on toll free no. 1800 1020 990 and 1800 22 44 30. In case of Individual Shareholders holding securities in demat mode who acquires shares of the Company and becomes a Member of the Company after sending of the Notice and holding shares as of the cut-off date i.e. September 18, 2021 may follow steps mentioned in the Notice of the AGM".

Detailed procedure for e-voting is provided in the Notice of Meeting. In case of any queries relating to e-voting you may refer to the FAQs for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of https:// www.evoting.nsdl.com/ or call on toll free no.:1800 1020 990/1800 224430 or send a request at evoting@nsdl.co.in. In case of any grievances connected with facility for remote e-voting or e-voting at the AGM, please contact Ms. Pallavi Mhatre, Manager, NSDL or send an email on evoting@nsdl.co.in NOTICE is also hereby given pursuant to the provisions of Section 91 of the

Companies Act, 2013 and Rules made thereunder, that the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Saturday, September 18, 2021 to Saturday, September 25, 2021 (both days inclusive) for the purpose of The Board of Directors of the Company has appointed Mr. Mahadev Tirunagari,

Practicing Company Secretary as Scrutinizer to scrutinize the voting process (both remote e-voting and e-voting during the AGM) in a fair and transparent manner. On behalf of the Board of Directors For Zenotech Laboratories Limited

Place: Hyderabad **Abdul Gafoor Mohammad** Date: September 3, 2021 Company Secretary & Compliance Officer Namokar Trade (India) Limited

Registered Office: Diamond Arcade, 5th - FR, FL - 504 68, Jessore Road, Kolkata – 700055 CIN:L51909WB1985PLC038407

Phone: +91-33-3297-7609; E-mail: ratan.namokar@gmail.com; Website:www.namokartrade.com NOTICE IS HEREBY GIVEN that the 40th Annual General Meeting (AGM) of the Company wi be held on Wednesday, September 29, 2021, at 11:00 a.m. at Diamond Arcade, 5th Floor, FL-504, 68, Jessore Road, Kolkata - 700055, to transact the business as mentioned in the Notice of AGM sent along with the Audited Financial Statements of the Company for the year ended

March 31, 2021, and the Board's Report and Auditors Report thereon.

Dispatch of the Annual Report, 2021, along with the AGM Notice, Attendance Slip and Proxy Form, has been completed on September 3, 2021. The Notice of AGM is also available on the website of National Securities Depository Limited (NSDL), i.e. https://www.evoting.nsdl.com. Notice is further given that the Company is providing electronic voting facility from a place other than the venue of AGM ('remote e-voting') to the members to exercise their votes on all the resolutions set forth in the Notice of AGM. The company has engaged NSDL for providing evoting facility. The details of remote e-voting are given below:

I) The remote e-voting will commence on Sunday, September 26, 2021 from 9.00 a.m. and ends on Thursday, September 28, 2021 till 5.00 PM. The e-voting module shall be disabled for voting thereafter, and no one shall be allowed to vote electronically after September 28, 2021 (5:00 PM).

(ii) The voting rights of Members shall be in proportion to their share of the paid-up share capital of the Company as on the cut-off date i.e. September 22, 2021. (iii) Notice of AGM has been sent to all the members whose names appeared in the Register of Members/Beneficial Owners as on September 1, 2021. Any person who acquires equity shares of the Company and becomes a Member after September 1 2021, and holding shares as on the cut-off date i.e. September 22, 2021, may obtain

call at Tel: +91-33-3297-7609. (iv) Once a vote is cast by the Member, he shall not be allowed to change i

the Login ID and Password by sending a request at ratan.namokar@gmail.com, or

(v) The facility of casting vote through ballot paper will be made available at the AGM and the eligible members attending the AGM shall be able to cast their vote at AGM

through ballot paper. (vi) The Members who cast their vote by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote again.

In case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting user manual for members available at the Downloads section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or contact Mr. Amit Vishal, Senior Manager, National Securities Depository Ltd., Trade World, 'A' Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Pare!, Mumbai —400 013, at the designated email IDs: evoting@nsdl.co.in or amitv@nsdl.co.in or at telephone nos. +91 22 2499 4600/ +91 22

NOTICE IS ALSO HEREBY GIVEN that pursuant to Section 91 of the Companies Act, 2013, that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Thursday, September 23, 2021 to Wednesday, September 29, 2021 (both days inclusive).

By Order of the Board of Directors For Namokar Trade (India) Limited

Place: Kolkata Date: 03-09-2021

Ratan Lal Baid **Managing Director** DIN: 07060481

WILLIAMSON MAGOR & CO. LIMITED Corporate Identity Number (CIN): L01132WB1949PLC017715

REGISTERED OFFICE: FOUR MANGOE LANE, SURENDRA MOHAN

GHOSH SARANI, KOLKATA-700001 TELEPHONE: 033-2210-1221, 2248-9434, 2248-9435 FAX: 91-33-2248-3683/8114/6265 E-mail: administrator@mcleodrussel.com, Website: www.wmtea.com NOTICE TO MEMBERS - 70TH ANNUAL

GENERAL MEETING AND E-VOTING Notice is hereby given that 70th Annual General Meeting ("AGM") of the members of the Company will be held on Tuesday, 28th September, 2021 at 3:00 P.M. (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OVAM") to transact the

The Notice convening AGM and the Annual Report of the Company has been sent through electronic mode on 2nd September, 2021 to all the members whose e-mail addresses are registered with the Company's Registrar and Share Transfer Agent/Depository Participant(s), in accordance with the MCA Circular Nos. 14/2020. 17/2020 and 20/2020 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020 and January 13, 2021, respectively (collectively referred to as "MCA Circulars") and SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 issued by the Securities and Exchange Board of India. The Notice and Annual Report for the Financial Year 2020-21 are available & can be downloaded from the website of the Company viz. www.wmtea.com and also on the website of Stock Exchange where Equity Shares of the Company are listed, viz., www.bseindia.com, www.nseindia.com and www.cse-india.com. The requirements of sending physical copy of Notice and Annual Reports for F.Y 2020-21 to the members have been dispensed with vide MCA and SEBI circulars.

business as set out in the Notice dated 12th August, 2021.

Members are provided with a facility to attend the AGM through electronic platform provided by National Securities Depository Limited (NSDL). Members may access the platform to attend the AGM through VC/OAVM at http://www.evoting.nsdl.com under the Shareholder/members login by using the remote e-voting credentials. The link for VC/OAVM will be available in shareholder/members login where the EVEN of Company will be

Members of the Company be and are hereby informed that pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended the members are provided with the facility to cast their vote on all the resolutions set forth in the Notice using electronic voting system (e-voting) provided by NSDL. The detailed e-voting instructions are as enumerated below:-

 (a) Date and time of commencement of remote e-voting: Friday. 24th September, 2021 at 9.00 a.m. (IST).

(b) Date and time of end of remote e-voting: Monday, 27th September, 2021 at 5.00 p.m. (IST).

(c) Cut-off date: Tuesday, 21st September, 2021. (d) The voting rights of the members shall be in proportion to the

number of equity shares held by them as on the Cut-off date i.e., Tuesday, 21st September, 2021. (e) Remote e-voting by electronic mode shall not be allowed beyond 5.00 p.m. on 27th September, 2021. The remote e-

voting module shall be disabled by the NSDL after aforesaid

date and time. (f) Those Members who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting, shall be eligible to vote through evoting during the AGM.

(g) Notice of Annual General Meeting inter alia containing the procedures of remote e-voting, e-voting during the AGM & attending the AGM through VC/OAVM are available on the web site of the Company at www.wmtea.com and on the

website of NSDL at www.evoting.nsdl.com. (h) Members who have acquired shares after the despatch of the Notice of AGM and before the cut-off date may approach the NSDL/ Company for issuance of the User ID and Password

for exercising their right to vote by electronic means. A member may participate in the AGM through VC/OAVM even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to cast their votes again.

 A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial owners maintained by Depositories as on the cut-off date only shall be entitled to avail facility of remote e voting or e-voting during the AGM.

Members holding shares in physical form, whose e-mail addresses

are not registered with the Company, may register their e-mail address by sending the scanned copy of signed request letter mentioning their name, folio number, number of shares held and complete postal address, self-attested copy of the PAN Card along with self-attested copy of any document (such as Aadhar Card/Driving License/Voter ID Card/Passport/latest Electricity Bill/ latest Telephone/Mobile Bill/Bank Passbook particulars) to the Company at aditi.dhanuka@mcleodrussel.com or to the RTA i.e. Maheshwari Datamatics Private Limited at mdpldc@yahoo.com. Members holding shares in demat form can register/update their e-mail address with their Depository Participants.

The Company has appointed Mr. A K Labh, a Practicing Company Secretary (Membership No. FCS 4848 / C.P. No. 3238) as Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner. In case of any queries you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no. 1800-222-990 or send a request to Ms. Pallavi Mhatra, Manager, NSDL, 4th Floor, 'A' Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai-400013; Email: evoting.nsdl.co.in/pallavid@nsdl.co.in; Telephone nos. +91-22-2499 4545/1800-222-990.

By Order of the Board Williamson Magor & Co. Limited Place: Kolkata Aditi Daga Date: 03.09.2021 **Company Secretary** 

Ahmedabad

financialexp.epapr.in





## સાર્વજનિક જાહેરાત તારીખ: ૦૨.૦૯.૨૦૨૧ ઓનલાઇન આવેદનપત્ર

#### આઇઆઇએફ્ટી એમબીએ (આઇબી)–૨૦૨૨–૨૦૨૪ની પ્રવેશ પરીક્ષા શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ) ની સ્થાપના એક સ્વતંત્ર/સ્વાયત્ત, આત્મનિર્ભર પ્રમુખ

પરીક્ષણ સંગઠન સ્વરૂપે કરવામાં આવી છે.

ભારતના વિદેશી વ્યાપારના ક્ષેત્રમાં દેશની અગ્રણી બિઝનેશ સ્કુલ સ્વરૂપે કૌશલ નિર્માણ હેતુ યોગદાન આપવા માટે ૧૯૬૩માં, ભારતીચ વિદેશ વ્યાપાર સંસ્થાન (આઇઆઇએકટી) ની સ્થાપના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત આવતા એક સ્વાયત્ત એકમ સ્વરૂપે કરવામાં આવી હતી. આ સંસ્થાન એક પ્રથમ ક્ષેણી માન્ય વિશ્વ વિદ્યાલય છે.

એનટીએ, આઇઆઇએફટી એમબીએ (આંતરરાષ્ટ્રીય વ્યાપાર) ૨૦૨૨–૨૪ કાર્યક્રમમાં પ્રવેશ માટે કોમ્પ્યટુર આધારિત પરિક્ષાનું

આચોજન, નીચે આપેલ વિવરણ અનુસાર કરશે.

પરિક્ષાની તારીખ	૦૫ ડિસેમ્બર ,૨૦૨૧ (રવિવાર, સવારે ૧૦.૦૦ વાગ્યાથી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી)
પરિક્ષાની પદ્ધતિ	કોમ્પ્યુટર આધારીત પરીક્ષા
પરિક્ષાની પેટર્ન	બહુ વૈકલ્પીક પ્રશ્નો
પરિક્ષાના કેન્દ્ર	ભારતના ૬૮ શહેરોમાં પરિક્ષાનું આચોજન કરવામાં આવશે.
લાચકાત	રનાતકમાં ૫૦ ટકા ગુણ સાથે, કોઇપણ વિષયમાં, માન્યતા પ્રાપ્ત, લઘુત્તમ ૩ વર્ષની રનાતકડિગ્રી (એસસી/એસટી/પીડબલ્યુડી ઉમેદવારો માટે ૪૫ટકા). રનાતકના છેલા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ આવેદન કરી શખેછે. ઉમરની કોઇ મર્યાદા નથી)
અનામત	એસસી/એસટી/ઓબીસી (એનસીએલ)/ પીડબલ્ચુડી/ સામાન્ય ઇડબલ્યુએસ/ કશ્મીરી પ્રવાસી માટે અનામત, ભારત સરકારના નિયમો અનુસાર
પ્રવાસીભારતીયો (એનઆરઆઇ) અને વિદેશી નાગરિક માટે	પ્રવાશી ભારતીયો (એનઆરઆઇ) અને વિદેશી નાગરિક માટે બેઠકો અનામત છે અને પ્રવેશ જીમેટ સ્કોર અને મુલાકાતના આધારે કરવામાં આવે છે.
ઓનલાઇન આવેદનપત્ર અને પરીક્ષા ફી જમા કરવાની તારીખ	૦૨ સપ્ટેમ્બર ,૨૦૨૧ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૧ સુધી. પ્રવાસી ભારતીય અને વિદેશી નાગરિક: ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ થી ૧૫ માર્ચ, ૨૦૨૨ સુધી.

લાચકાત/પરિક્ષા યોજના/સમયગાળો/સમય/અનામત/આવેદન ફી/પરીક્ષા શહેરોની ચાદી/ મહત્વપુર્ણ તારીખો અને પ્રવેશ પ્રક્રિયા વગેરે તમામ સુચનાઓ, સુચના બુલેટીનમાં દર્શાવામાં આવેલ છે, જે એનટીએની વેબસાઇટ https://iift.nta.nic.in પ૨ઉપલબ્ધ છે. પરીક્ષામાં ભાગ લેવા માંગતા ઉમેદવારો પ્રવેશ માટે સુચના બુલેટીન https://iift.nta.nic.in જોવું. આવેદન ફક્ત ઓનલાઇન કરી શકાશે અને ઉપર દર્શાવેલ સમયગાળા દરમિયાન પરિક્ષા ફીની ચુકવણી ડેબીટ/ક્રેડીટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેંકિંગ તેમજ પેટીએમના માધ્યમથી ફક્ત ઓનલાઇન કરવામાં આવશે. કોઇપણ પુછપરછ અથવા સ્પષ્ટતા માટે ઉમેદવારો એનટીએ <u>હે</u>લ્પ ડેસ્ક નં.૦૧૧–૪૦૭૫૯૦૦૦ અથવા iiftmba-ib@nta.ac.in પર સંપર્ક કરી શકે છે.

> ડૉ. સાદ્યના પરાશર વરિષ્ઠ નિર્દેશક (પરીક્ષા)

davp 21354/11/0012/2122

# ાટા કેપિટલ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ જાસ્ટર્ડ ઓફીસ: ૧૧મો માળ, ટાવર એ, પેબિનસુલા બિઝનેસ પાર્ક, ગણપતરાવ કદમ માર્ગ, લોઅર પરેલ, મુંબઇ - ૪૦૦૦૧૩ CIN: U67190MH2008PLC187552)

માંગણા નોટીસ

સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ (નિયમો) ના નિયમ 3 સાથે વંચાતી સિક્યોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨, (એક્ટ) ની કલમ ૧૩(૨) હેઠળ જત જણાવવાનું કે ટાટા કેપિટલ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ (ટીસીએચએફએલ) ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ કાયદા હેઠળ અને નિયમોના નિયમ 3 સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ મળે સતાની રૂએ અગાઉથી નીચે જણાવેલ તારીખે વિગતવાર માંગણા નોટીસ કાચદાની કલમ ૧૩(૨) હેઠળ અહીં નીચે જણાવેલ દેવાદાર(રો)/સહ–દેવાદાર(રો)/જમીનદાર(રો) (બધાને અલગ અલગ રીતે અથવ એક સાથે દેવાદારો)/કાનુની વારસદાર(રો)/કાનુની પ્રતિનિધિ(ઓ) ને નીચે આપેલ વિગતો અનુસાર સબંધિત નોટીસ/સોની તારીખથી દૃ૦ દિવસની અંદર સંબંધિત માંગણા નોટીસ/સોમાં જણાવેલ ૨૬મો સુક્ત જ્વા માટે પાઠવી હતી. જણાવેલ નોટીસોની નકલો રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. મારફત બજવવામાં આવી છે અને નીચે સહી કરનાર પાસે ઉપલબ્ધ છે, અને જણાવેલ દેવાદાર(રો)/કાનુની વારસદાર(રો)/કાનુન પ્રતિનિધિ(ઓ), જો તેઓ ઇચ્છે તો તેની સબંધિત નકલો સામાન્ય ઓફીસના કલાકો દરમિયાન કોઇપણ ચાલુ દિવસે નીચે સહી કરનાર પાસેથી મેળવી શકે છે.

મતામાના આ, ત્યા તમારા મછે તા તથા તમાવત વહલા તામાવ્ય આફાતથા કલાકા દરામવાલ કાઇપણ ચાલુ દિવસ લાય સહા કરનાર પાસથા મળલા શકે છે. ઉપરોક્તના અનુસંધાનમાં પરિણામે અહીં એક વખત ફરી જણાવેલ દેવાદાર(રો)/કાનુની વારસદાર(રો)/કાનુની પ્રતિનિધિ(ઓ) ને સબંધિત નોટીસ(સોની તારીખથી દૃ૦ દિવસની અંદર ટીસીએચએકએલ જણાવેલ દેવાદાર(રો) દ્વારા કરાયેલ લોન કરાર અને અન્ય દસ્તાલેબ)(લખાણો, જો કોઇ હોય તો તેની સાથે વાંસીને તેમના લાગતા વળગતા નામો સામે અહીં નીચે જણાવેલ રકમોની ચુકવણી અને/ અથવ છુટકારાની તારીખ સુધી નીચે કોલમ (કી)માં જણાવેલ લાગતી વળગતી તારીખોથી નીચેની વિગતો અનુસાર અન્ય વ્યાજ સહિત, લાગતી વળગતી માંગણા નોટીસ/સોમાં ખાસ કરીને જણાવ્યા મુજબ દરે વધારાન વ્યાજ, આકરિયક ખર્ચ, બોજા, સાર્પ વગેરે સહિત ચુકવણી કરી જવા નોટીસ આપવામાં આવે છે. લોનની પુન ચુકવણી માટે સિક્ચોરીટી તરીકે, નીચેની સિક્ચોર્ડ એસેટ(ટો) જણાવેલ દેવાદાર(રો) દ્વારા અનુકરે ને સ્પોત્રોએએ કે એક તો પ્રતિ કર્યોલ છે. ીસીએચએફએલને ગીરો કરાયેલ છે.

ટાસા	અચઅફઅલન	ગારા કરાયલ છ.					
ક્રમ નં.	લોન એકાઉન્ટ નંબર	દેવાદાર(રો) કાનુની વારસદાર(રો)/ કાનુની પ્રતિનિધિ(ઓ) ના નામ	કુલ બાકી રકમ (રૂા.)	માંગણા નોટીસની તારીખ અને એનપીએની તારીખ	9	10668908 & 10000860	
1	9448931 & 9711186	શ્રી ચેતન બારુ શ્રીમતી દિપીકા બારુ	₹ 5,30,910/-	02-08-2021 07-06-2021	એ(	<b>ક્યોર્ડ એસેટો</b> રિચા કુલ ૫૪ .ચાર્ડ,કુલ દૃદૃ	
એક અહે અહિ અહિ	રપાલિકા પ્રોપત ગ હિસ્સા પ્રમા I પરિસર/કેમ્પર પ્રકારો, રહેણાંદ ર ૬–૦૩ ગૂંઠા દ	સ્થાવર મિલકતો/ગીરો મિલકતોની વિગ ઈ નં. રદ્દદ્દ, જેનુ માપ ૧૭૦.૫૦ ચો.મી. છે તેન ણ હિસ્સા સાથેની સ્થાવર મિલ્કતના દરેક ર ૧ કે જે નીલકંઠ નાગર તરીકે ઓળખાય છે તે ૬ ઉપયોગ માટેની બિન-ખેતી જમીન જે રેવન્જ ૭, અંજાર વોર્ડ નં. ૧, જે મોજે ગામ: અંજાર, પે તુ:સીમા: પૂર્વપ્લોટ નં. ૯૫, પશ્ચિમ: પ્લોટ નં. ૯૩	ની સાથે તેની વ ખધિકારો, હિર ના દરેક આંત યુ સર્વે નં. ૨૮૨ ટા જિહ્યો: અંજા	નીચેની જમીનાં સા અને ભાગ રિક અને બાહ્ય !/૧ છે જેનું માર ૨ સિટી, જિલો:	વહે અવ રેર્સ જિલ હિસ્	આયેલ હિસ્સ ને બહારના હ દીડેન્સીયલ હે વ્રો કડી, જિલે સ્સા. ચતુ:સી દરનો કોમન	ો ક
આંહ	ારિક રોડ				10	10680153 &	l

2	10531439	શ્રી અશોકભાઇ પુરુષોત્તમદાસ પ્રજાપતી, શ્રીમતી શાંતાબેન પુરુષોત્તમભાઇ પ્રજાપતી	₹ 27,27,306/-	10-08-2021 05-04-2021

**સિક્ચોર્ડ એસેટો/સ્થાવર મિલકતો/ગીરો મિલકતોની વિગત** : ફ્લેટ નં.ઓ-૭૦૨, બ્લોક એમ 9મો માળ, જેનું માપ ૧૦૭.૨.૫૦ ચો.મી. કાર્પેટ એરિયા છે તેની સાથે ૯. ચો.મી, કુલ ૪૫.૧૬ ચો.મી તેની નીચેની જમીનાં સળંગ હિસ્સા પ્રમાણ હિસ્સા સાથેની સ્થાવર મિલ્કતના દરેક અધિકારો હિસ્સા અને ભાગ અને પરિસર/કેમ્પસ કે જે સદગુરુ શરણ તરીકે ઓળખાય છે જેનું બાંધકામ બિન ખેતી જમીન પર રહેણાંક ઉપયોગ માટે કરવામાં આવ્યુ હતુ, જેનો રેવન્યુ સર્વે નં. ૪૬૬/૨ છે જેનું માપ હે.એરિચા ૦–૪૦–૪૭ ચો.મી.છે. જેની ટીપી સ્કીમ નં. ૧૧૯, ફાઇનલ પ્લોટ નં ૧૦૮ચર છે તેના પૈકી, જે મોજે ગામ નિકોલ, તાલુકો અસારવા. પેટા જિલો: મદાવાદ (નિકોલ) જિલો: ગુજરાતનુ અમદાવાદ. ચતુઃસીમા: પૂર્વ: <del>ક</del>્લબ હાઉસ, પશ્ચિમ: માર્જિન જમીન, ઉત્તર માર્જિન જમીન, દક્ષિણ: ફ્લેટ નં. ૭૦૧

「「	0070064	₹	10-08-2021		
3	9278864	શ્રી કનુભાઇ છગનભાઇ પ્રજાપતી	9,93,881/-	10-05-2021	
સિક્યોર્ડ એસેટો/સ્થાવર મિલકતો/ગીરો મિલકતોની વિગત : ઘર નં. નં. ઇ–૮૮, રહેણાં કહેતુ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સેક્ટર નં. ૭૩માં, ઇડબ્લ્યુએસ કોલોની બાંધવામાં આવેલ,					
જે તાલુકો: ગાંધીધામ, સબ રજિસ્ટ્રેશન ડિસ્ટીટ: ગાંધીધામ, જિલોઝ કચ્છ, ચતુ:સીમા પૂર્વ:					
ટિવ	ટેનામેન્ટ નં. ઇ-૯૦, પશ્ચિમ: ટેનામેન્ટ નં. નિ૮૮, ઉત્તર: ખુલી જમીન અને ટે.નં. ઇ-૮૨ અને ઇ-				

	૮૩, દક્ષિણ: રોડ ₄ 0171477 શ્રી સુખલાલ એમ. ચોંધરી ₹ 10-08-2021					
ı	ટેનામેન્ટ નં. ઇ	–૯૦, પશ્ચિમ: ટેનામેન્ટ નં. –િ૮૮, ઉત્તર: ખુલી જમી				
		કાઉસિંગ બોર્ડ દ્વારા સેક્ટર નં. ૭૩માં, ઇડબ્લ્યુએસ ધીધામ, સબ રજ્સ્ટ્રેશન ડિસ્ટીટ: ગાંધીધામ, વિ				

ı			શ્રામતા લાલાળન સુખલાલ ચાવરા	3,40,909/-	07-06-2021
I	સિક	ચોર્ડ એસે	શે/સ્થાવર મિલકતો/ગીરો મિલકતોની વિગત : રો	મેવી સ્થાવર મિ	મેલ્કતના ભાગ
I	અને	ો હિસ્સા કે વે	લો ફ્લેટ નં. આકૃતિ –કે–૩૦૯ , ત્રીજો માળ, જેનું મા	ા ૬૦ ચો.વા૨,	<del>ે કેસર સિ</del> ટીમાં
I	આવે	વેલ છે, જેનો	રેવન્યુ સર્વે/બ્લોક નં. ૪૫૭૨, રેવન્યુ સર્વે બ્લોક નં	. ૪૫૨/૧, ૪૫૫	ટગ્ઠ૯,૧,૪૫૫
I	પૈકી	૨, રેવન્યુ	સર્વે બ્લોક નં. ૪૫૭/૨, ૪૬૦ પૈકી ૧, રેવન્યુ સવે બ્લ	લોક નં. ૪૬૦/૧	ા૧, રેવન્યુ સર્વે
I	બ્લો	ાક નં. ૪૬૦/	૧૨, રેવન્યુ સર્વે બ્લોક નં. ૪૬૦ પૈકી ૧, કેસર સોપાન	ત પાસે, ઝાચડર	ત રિસર્ચ સેન્ટર
ı	luisa	സ ചാന്	લ્બાવળા હાઇલે મોજે મોરીસા–આંગોદર વાલકો	ı. ənnis જિલ	บ. วหมะเดเะ

ગુજરાત. ચતુઃસીમા: પૂર્વ: કે––૩૦૮ આકૃતિ, પશ્ચિમ: કે–૩૧૦ આકૃતિ,ઉત્તર: રોડની ખુલી જમીન

દક્ષિણ: અગાશીની ખુલી જમીન

_ · •						
Ę	0000000	શ્રી રોહિતભાઇ શાંતિલાલ કાકણીચા	₹	10-08-2021		
5	9898232	શ્રીમતી પ્રફુલાબેન રોહિત કાકણીયા	44,50,822/-	09-04-2021		
સિક	ક્યોર્ડ એસેટ	ો/સ્થાવર મિલકતો/ગીરો મિલકતોની વિગત : એવ	ી સ્થાવર મિલ્	કતના ધિકારો,		
ભા	ગ અને હિસ	સા <del>કે</del> જેનો ફ્લેટ નં. ૧૦૧, જેનું માપ ૮૬.૯૦ ચો.મી, છે	, જેનું સળંગ હિ	કેસ્સા પ્રમાણ તે		
બિલ	:ડીંગની જ <sup>્ર</sup>	ીને હેઠળ છે અને તે પરિસર/કેમ્પસ કે જે અતુલ્યમ	એલાઇટ તરીકે	કે ઓળખાય છે		
તેમાં	ાં રહેલા દરે	ક આંતરિક એ બાહ્ય અધિકારો, જે રહેણાંક ઉપયો	ગ માટે બિન પે	ોતી જમીન પર		
બાંધવામાં આવ્યા છે, જેનો રેવન્યુ સર્વે નં.,૫૭/૧,૫૭/૨૩,૫૭/૩ પૈકી, ટીપી સ્કીમ નં. ૪, ફાઇનલ						
પ્લોટ નં. ૭૫૬ પૈકી જે તાલુકો: રાજકોટ, જિલો: ગુજરાતનું રાજકોટ, ચતુ:સીમા: પૂર્વ: પેસેજ, લિફ્ટ,						
ειε	દાદર, ખુલુ આકાશ, ફ્લેટ નં. ૧૦૨ અને ૧૦૩, પશ્ચિમ: ખુલુ આકાશ અને માર્જિન જગ્યા, ઉત્તર:					

l	ખુલ્	ુ આકાશ એ સ્ટાહ્ય સ્ટાહ્ય	માર્જિન જગ્યા, દક્ષિણ: ફ્લેટનું મુખ્ય બારણુ, દાદ	2, ખુલુ આકાશ	l <b>.</b>
	6	9936631	શ્રી કોશિક મહેશભાઇ ગરૂર શ્રી મહેશભાઇ હિંમતભાઇ ગરૂર શ્રીમતી હંસાબેન ગરૂર	₹ 4,28,985/-	10-08-2021 09-04-2021
સિક્ચોર્ડ એસેટો/સ્થાવર મિલકતો/ગીરો મિલકતોની વિગત : એવી સ્થાવર મિલ્કતન					લ્કતના તમામ

અધિકારો, હિસ્સા અને ભાગ કે જેનો ફ્લેટ નં. રઇ–૨૦૬ બીજો માળ, જેનું માપ ૪૧.૭૧ રો..મી છે એટલે કે ૪૪૯. ચો.ક્રૂટ, એટલે કે ૦૦.૦૦ ચો.વારની સાથે ૧૩.૯૦ ચો.મી અને ૩૭.૦૭. જેનું સળં હિસ્સા પ્રમાણ તે બિલ્ડીંગની જમીને હેઠળ છે અને તે પરિસર/કેમ્પસ કે જે શાંતિ રેસિડન્સી તરીકે ઓળખાય છે તેમાં રહેલા દરેક આંતરિક એ બાહ્ય અધિકારો, જે રહેણાંક ઉપયોગ માટે બિન ખેતી જમીન પર બાંધવામાં આવ્યા છે, જેનો રેવન્યુ સર્વે નં. ૭૪૯ છે, બ્લોક નં. ૦, જેનુ માપ : ૩૯૬૦.૦૦ ચો.મી છે પૈકી જે કડી મ્યુનિસિપલ વિતારમાં સબ ડિસ્ટ્રીક્ટ:કડી, જિલો: ગુજરાતના મહેસાંણામાં આવેલું છે. ચતુઃસીમાઃ પૂર્વઃ ફ્લેટ નં. ૨/ઇ ૨૦૫, પશ્ચિમઃ આંતરિક રોડ, ઉત્તરઃ ફ્લેટ નં. ૨/ઇ ૨૦૩ દક્ષિણઃ ફ્લેટ નં. ૨/ઇ ૨૦૭ અને દાદર

-	9757201	શ્રા રાજરા અરાવદભાદ શાહ	₹	10-08-2021	ь
'	9/5/201	શ્રીમતી સરોજબેન અરવિંદલાલ શાહ	7,60,365/-	09-04-2021	ŀ
સિક	ચોર્ડ એસે	ો/સ્થાવર મિલકતો/ગીરો મિલકતોની વિગત : એ	ાવી સ્થાવર મિ	લ્કતના તમામ	Ь
અદિ	પ્રકારો, હિસ્	સા અને ભાગ કે જેનો ફ્લેટ નં. સી–૬૦૧, બ્લોક સીમ	ાં ફક્રો માળ , જે	નું માપ દૃદ્દ.૮૮,	ŀ
એટ	લે કે ૭૨૦,	૦ ચો.ફૂટ છે,જેનું સળંગ હિસ્સા પ્રમાણ તે બિલ્ડીંગ	ાની જમીને હે	કળ છે અને તે	ŀ
นโฮ	સર/કેમ્પસ	કે જે શિવેશ–દૃસ્વ તરીકે ઓળખાય છે તેમાં રહેલ	ા દરેક આંતિ	ટેક અને બાહ્ય	ŀ
અદિ	ધકારો, જે ર	<b>હેણાંક ઉપચોગ માટે બિન ખેતી જમીન પર બાંધ</b> વા	માં આવ્યા છે,	જેનો બ્લોક નં.	ŀ
ફિરવ	દ્દર૧ છે, જેનુ માપ : ૭૫૮૮.૦૦ ચો.મી છે જે મોજે ગામ: લાંભા, તાલુકો: વટવા, સબ				
ડિસ્	ડિસ્ટ્રીક્ટ:અમદાવાદ–૧૧ (અસલાલી), જિલો:ગુજરાતનું અમદાવાદદ્બ ચતુ:સીમા: પૂર્વ: ગોચર 📙				
જમી	ાન, પશ્ચિમ	: બ્લોક નં. ૬૩૯, ઉત્તર: બ્લોક નં. ૬૨૨ અને	૬૨૩, દક્ષિણ:	ગામની ટાંકી	t

l	9935978	<b>શ્રા અર્જુનાસહ આઇ. સિસોદીચા</b> (દેવાદાર),	₹	12-08-2021	l
8	. 8	શ્રીમતી નિધિ એ. સિસોદીચા અને	72.43.517/-	09-04-2021 &	r
	10469662	<b>શ્રી મદનસિંહ આર. રોચલ</b> (સહ-દેવાદાર)	12,43,311/-	04-04-2021	ŀ
(5	ક્ચોર્ડ એરોટ	ો/સ્થાવરમિલકતો/ગીરો મિલકતોની વિગત : બં	ાલો/ચુનિટનં.	એ–૬,પૈકીસબ	Į,
чG	ોટનં. ૨, ક્ષે	મફળ ૧૨૮ ચો.મી. તેમજ ૯૫.૦૦ ચો.મી. કુલ ક્ષેત્ર	eo.853.00	ચો.મી. ક્ષેત્રફળ	ľ
9.5	,૮.૯૪ ચો.મી	. "સંગાણી વ્રજભુમી" તરીકે જાણીતી સ્કીમમાં, સર્વે	નં.૧૪૨૭,૧૪	૩૧/૧,૧૪૩૧/૨,	ľ
૧ર	35/9,983	9/٩,٩૪૩૮,٩૪૩૯/૨,٩૪૩૯/૪,٩૪૪૦,٩૪૪٩,٩૪٢	<b>૧૨,૧૪૪૫,૧</b> ૪૪	છ, કુલક્ષેત્રફળ	ľ
		. ફાઇનલ પ્લોટનં. (૩૪૦+૩૪૫/૧+૩૪૫/૩) ૧ ટ			
(c	ાટવા અસલા	લી) ક્ષેત્રફળ ૨૩૯૬૩ ચો.મી. સબ પ્લોટ નં. ૧, ક્ષેત્ર	<b>१५८० ११</b> ६६८ २	ો.મી. સબ પ્લોટ	ı
		૧૨૨૯૫ ચો.મી. મોજે ગામ વટવા, તાલુકો વટવ			l
		લો અમદાવાદ, ગુજરાત ખાતે આવેલ સ્થાવર મિલ <b>:</b>			ľ
ચ	તુ:સીમા: પૂર્વ	: ખુલો પ્લોટ, પશ્ચિમ: ૨૫ કુટનો અંદરનો રોડ, ઉ	તર: યુનિટનં.	. એ–૫, દક્ષિણ:	ŀ

#### શ્રી દિનેશ લક્ષ્મણસિંહ સોલંકી શ્રીમતી લક્ષ્મીબેન લક્ષ્મણસિંહ સોલંકી 14,24,619/- 04-04-2021 સિક્યોર્ડ એસેટો/સ્થાવર મિલકતો/ગીરો મિલકતોની વિગત : હાઉસ નં. બી-૭, બિલ્ડ અપ એરિયા કુલ ૫૪.૭૫ ચો.મી. ગ્રાઉન્ડ ફ્લોર, ક્ષેત્રફળ ૩૧.૫૦ ચો.મી, પહેલો માળ, ૩૫.૩૯ ચો.ચાર્ડ,કુલ દ્દ.૮૮ ચો.મી. તેમજ ૩૧.૩૬ કુલ ૮૬.૧૧ ચો.મી. બિલ્ડીંગની જમીનમાં વ વહેચાચેલ હિસ્સો અને અશોક વાટીકા તરીકે જાણીતી પ્રિમાઇસીસ/કેમ્પસમાં તમામ અંદર અને બહારના હકો , રેવન્યુ સર્વે નં. ૧૬૬ (જુનો સર્વે નં. ૭૧૭) ક્ષેત્રફળ ૧૪૩૮૯.૦૦ ચો.મી.ની રેસીડેન્સીયલ હેતુસરની બિન ખેતીલાયક જમીન પર બંધાયેલ મોજે ગામ: નાની કડી, પેટા િજાતો કડી, જિલો મહેસાણા, ગુજરાત ખાતેની સ્થાવર મિલકતના તમામ હકો, ભાગ અને હિસ્સા. ચતુઃસીમાઃ ઉત્તરઃ હાઉસ નં. ૮/એ, દક્ષિણઃ હાઉસ નં. ૭/એ, પુર્વઃ લેન, પશ્ચિમ

10	10680153 &	શ્રી રમજાનભાઇ હુસૈનભાઇ રઉમા	₹	12-08-2021		
IU	10135902	શ્રીમતી હાફિજા રમજાનભાઇ રઉમા	12,09,153/-	07-06-2021		
<b>સિક્ચોર્ડ એસેટો/સ્થાવર મિલકતો/ગીરો મિલકતોની વિગત</b> : ટેનામેન્ટ નં. એમ ૧૫૪૪, બિલ્ડ						
અપ	ા એરિયા પર.	૭૬ ચો.મી., બિલ્ડીંગની જમીનમાં ન વહેચાચેલ હિ	કેસ્સો અને ગુ	જરાત હાઉસિંગ		
બોડ	ર્ડ–૪૪ મિગ ((	રૈસ) તરીકે જાણીતા પ્રિમાઇસીસ/કે મ્પસના તમાર	ા અંદરના અને	ો બહારના હકો		
ધર	ાવતી રેવન્યુ	સર્વે નં. ૧૬૭–૧૬૮, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૭,	ફાઇનલ પ્લો	ટ નં. ૯૧, સીટી		
સર્વે	વોર્ડનં.૧૨પૈ	કીની રેસીડેન્સીયલ હેતુસરની બિન ખેતીલાયક વ	<b>૪મીનપ૨</b> બંધા	ચેલ દુધસાગર		
ડેરી	ડેરી, પેટા ડિલો રાજકોટ, જિલો રાજકોટ, ગુજરાત રાજ્ય ખાતેની મિલકતના તમામ હકો, ભાગ					
અને હિસ્સા. ચતુઃસીમા: પૂર્વ: ટેનામેન્ટ નં. એમ ૧૫૪૩, પશ્ચિમ: ટેનામેન્ટ નં. એમ-૧૫૪૫, ઉત્તર:						
પાછળનું માર્જિન અને ટેનામેન્ટ નં. એમ ૧૫૩૨, દક્ષિણ: માર્જિન સ્પેશ રોડ						

	, .				
	TCHHF0642000100005997	શ્રી હામેરસિંઘ પ્રેમસિંઘજી	₹	12-08-2021	
11	& TOUR R 004000400000000	કાશ્યુત	11,63,666/-	06-05-2021	
	TCHHL0642000100003502				
સિક્ચોર્ડ એસેટો/સ્થાવર મિલકતો/ગીરો મિલકતોની વિગત : ફ્લેટ ન . ૨૦૪, બ્લોક બી, બીજો					
માળ, ક્ષેત્રફળ એરિયા ૩૨.૮૨ રો.મી., ફુલ ક્ષેત્રફળ ૩૪.૭૪ રો.મી., તેમજબિલ્ડીંગની જ્મીનમાં					
ન વહેચાયેલ હિસ્સો અને સિગ્નેચર પ્રાઇડ તરીકે જાણીતી પ્રિમાઇસીસ/ કેમ્પસમાં અંદર અને					
બહારના હકો ધરાવતી ખાતા નં. ૬૭૬, બ્લોક/સર્વે નં. ૫૦૫, ક્ષેત્રફળ હેક્ટર અરે ૦–૨૯–૩૪					
(- )					

(જુનો ખાતા નં.૫૭૬,જુનો સર્વે નં.૧૬૭)આક્ટ ગ્રા.૪.૨૫,ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.૧૧૮, ફાઇનલ વોટ નં. ૮૩ ક્ષેત્રફળ ૧૩૯૭ .૦૬ ચો.મી., કુલ ક્ષેત્રફળ ૧૭૬૦ ચો.મી.ની રેસીડેન્સીયલ હેતુસરની બિન ખેતીલાચક જમીન પર બંધાચેલ મોર્જે ગામ– સિંગારવા, પેટા જિલો–અમદાવાદ, ઝોન– ૧ઃ (નિકોલ), તાલુકો–દસ્કોઇ, જિલો અમદાવાદ, ગુજરાત ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુઃસીમા: પુર્વ: ફ્લેટનં. બી–૨૦૩, પશ્ચિમ: ફ્લેટ નં. એ/૨૦૩, ઉત્તર: ફ્લેટ નં. બી/૨૦૫ દક્ષિણ: સોસાચટી બાઉન્ડ્રી.

12 98783	0070000	શ્રી સચિન સક્સેના, શ્રીમતી ચારુ સક્સેના,	₹	12-08-2021
	96/6362	શ્રી વિજયકુમાર સક્સેના	29,83,391/-	07-09-2018
સિક્યોર્ડ એસેટો/સ્થાવર મિલકતો/ગીરો મિલકતોની વિગત : પ્લોટ નં. ૫૪, ક્ષેત્રફળ ૧૪૪.૯૨				

એટલે કે ૧૫૬૦.૦૦ ચો.ક્રુટ, વિકેન્ઝા વનક્કમ તરીકે જાણ ોતી પ્રિમાઇસીસ/કેમ્પસમાં અંદર અને બહારના તમામ હકો ધરાવતી બ્લોક નં. ૮૬, ૮૮, ૯૧, પૈકીની રેસીડેન્સીયલ હેતુસરની બિન ખેતીલાયક જમીન પર બંધાયેલ મોજે ગામ કલાર્લ તાલકો– કલાલી. જિન્નો વડોદરા. ગજરાત ખાતેની મિલકતના તમામ ઠકો. ભાગ અને ઠિસ્સા ચતુઃસીમા:પુર્વ:પ્લોટ નં.૫૯,૫ક્ષિમ:૭.૫૦ મીટરસોસાયટીનો રોડઉત્તર:પ્લોટ નં.૫૩,દક્ષિણ પ્લોટ નં. ૫૫.

مال حال المالية عالمة والمالة عالمالة المالة الم

ı	10 100	10374779	શ્રા નાાતન ગારદાનભાઇ દામાાડચા	₹	12-08-2021
l	13	103/4//9	શ્રીમતી જસ્મીતાબેન નીતિનભાઇ દોમાડિયા	18,30,398/-	03-06-2021
l	સિ	ક્યોર્ડ એસેટ	ો/સ્થાવરમિલકતો/ગીરોમિલકતોની વિગત :પ્લો	ટનં.૧૦૩/એન	ક્ષેત્રફળ ૪૯.૯૮
l			કે ૫૩૭.૯૮ ચો.કૂટ, ગોકુલધામ તરીકે જાણીતી, રેલ		
l	પ૪	૩૨૯.૦૦ ચો.	.મી., ચીફ એક્ઝીક્યુટીંવ ઓફીસર જામનગર ર	મેરિયા ડેવલોપ	ોન્ટ ઓથોરીટ <u>ી</u>
l	(%	એડીએ)નો	લેઆઉટ પ્લાન નં. જેવીવીએસ/ટીઇકે/૧૪૨	/૧૮/૬/૨૦૨૮	હુકમ તારીખ
l	૨૧	.09.2005	અને પછી સેક્રેટરી, એક્ઝીક્યુટીવ કમીટી ડેપ્યુટી	ડિસ્ટ્રીક્ટ ડેવલો	પમેન્ટ ઓફીસ
l	(રેવન્યુ), જિલા પરાાયત જામનગર, તા. ૨૮.૦૩.૨૦૦૭, હુકમ નં. આરઇવી/૧/બીકેએસ/૨જી.				
l	નં.૧૧૭/૨૦૦૭ રેસીડેન્સીયલ હેતુના ઉપયોગ માટે બિન ખેતીયાલયક કરવામાં આવી છે,				
l	જા	મનગર એ	રેચા ડેવલોપમેન્ટ ઓથોરીટી નં. જેવીવીએસ	/ટીઇકે/વી.પી./ર	<b>એસ–૨૧૨૧/એ</b>
l	99	૧૪/૪૮૬૩ ત	ા.૨૦.૧૦.૨૦૧૧ ઇમીગ્રેશન હુકમ મુજપ્લાન પ્લો ટ૰	તં. ૧૦૩ મુજબ ક્ષે	૧૪.૪૩૪ ૫૩ ફ્રા
l	ચો.	મી., જે	પ્લોટ નં. ૧૦૩ જામનગર એરિયા ડે	વલોપમેન્ટ ૨	નોથોરીટી નં.
l	જેવં	ોવીએસ/ટી	એકે/વી.પી./એ–૧૧૧૪/એસ–૨૧૨૧/એ–૧૧૧૪/૪	૮૬૪ તા.૨૦.૧૦	.૨૦૧૧, ને કુલ
l			નમાં બંધાચેલ અને સબપ્લોટ નં. ૧૦૩/એ થી ૧૦૩		
l	26	ાજીત સાગર	રોડ, પેટા જિલો અને જિલો જામનગર સીટી, ગુજ	રાત ખાતેની મિ	લકતનાં તમામ
ı	د ـ ا	· .	\ O · · · · · · · · · · · · · · · ·	. /- \ G	

હકા, ભાગ અને હિસ્સા. ચતુઃસામાઃ ઉત્તરઃ સબ પ્લાટ ન. ૧૦૩/અમ, દક્ષિણઃ સબ પ્લાટ ન. ૧૦૩/ઓ, પુર્વઃ પ્લાટ નં. ૧૬૧ અને ૧૬૨, પશ્ચિમઃ ૭.૫૦ મીટર પહોળો રોડ				
	10015186 & 10019339 & 10570150	શ્રીમતી પારુલબેન હિતેષભાઇ ડોડિયા શ્રીમતી રમાબેન હિંમતલાલ ડોડિયા	₹ 15,64,108/-	17-08-2021 10-05-2021
<b>સિક્ચોર્ડ એસેટો/સ્થાવર મિલકતો/ગીરો મિલકતોની વિગત</b> : પ્લોટ નં. ૧૧૪, સબ પ્લોટ નં.				
૧૧૪/૧ +૨/૧ પૈકી, ઉત્તર રોડ, જમીનની પુર્વ બાજુ ૩૫.૫૩ ચો.મી. બિલ્ડીંગનો ગ્રાઉન્ડ ફ્લોર,				
લીવીંગ ૩મ. કીરાન, ટોઇલેટ, સીડીઓ અને પહેલો માળ, બેડ્રગ્મ, પેન્ટીરમ, સીડીઓ અને				

ઉપરનો ટેરેસ તેમજ બિલ્ડીંગની જમીનમાં ન વહેચાચેલ હિસ્સા સહીતની હપલિયા પાર્ક તરીકે જાણીતી પ્રીમાઇસીસ/કેમ્પસમાં તમામ અંદર અને બહારના હકો ધરાવતીી સર્વે નં. ૧૨૨ પૈકી (જમીન એક્ટ ૬.૦૦ ગુંઠા), મોજે ગામ- કોઠારીયા, પેટા જિલો અને તાલુકો રાજકોટ, જિલો-રાજકોટ, ગુજરાત ખાતેની મિલકતના તમામ હકો, ભાગ અને હિસ્સા. ચતુઃસીમાઃ પુર્વ: પ્લોટ નં.૧૧૩, ક્ષેત્રફળ ૧૧.૦૦ , બાજુની આખી/સપુર્ણ દિવાલ, પશ્ચિમ: સબ પ્લોટ પૈકી બિલ્ડીંગ ક્ષેત્રફળ ૧૧.૦૦ દિવાલ, ઉત્તર: ૯.૦૦ મીટરનો રોડ, ક્ષેત્રફળ ૩.૨૩, દક્ષિણ: પ્લોટ નં. ૧૧૫ ક્ષેત્રફળ ૩.૨૩.

4-	10242494	શ્રી સમિર નવિનચંદ્ર શાહ	₹	13-08-2021	
15		શ્રી નવિનચંદ્ર ધનજીભાઇ શાહ	16,63,295/-	09-04-2021	
સિ	ક્યોર્ડ એસેટ	ો/સ્થાવર મિલકતો/ગીરો મિલકતોની વિગત	ા : ટેનામેન્ટ ન	i.૧૫, ક્ષેત્રફળ	
૧૭૧.૬૬ ચો.મી., બિલ્ડ અપ એરિયા ૬૮.૦૬ ચો.ચાર્ડ, વખારીયા નગર ૩ તરીકે જાણીતા					
પ્રીમાઇસીસ/કેમ્પસમાં અંદર અને બહારના તમામ હકો અને બિલ્ડીંગની જમીનમાં ન					
વહેચાચેલ હિસ્સો ધરાવતી રેવન્યુ સર્વે ન . પદ્દ૮/૧ (સર્વે નં .૫૭૫/૧) અને સર્વે નં . પદ્દ૮/૨ મર્જ					
પછી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨, ફાઇનલ પ્લોટ નં. ૨, ૩ અને ૯ પૈકી, ફાઇનલ પ્લોટ નં. ૯,					
પ્લોટ નં. ૧૫, સીટી સર્વે નં. ૮૯૭, બ્લોક નં. ૧૫, પૈકી,ની રેસીડેન્સીયીલ હેતુસરની જમીન પર					
બંધાચેલ મોજે ગામ કલોલ, તાલુકો– પેટા જિલો– કલોલ, જિલો–ગાંધીનગર, ગુજરાત ખાતેની					
સ્થાવર મિલકતના તમામ હકો, ભાગ અને હિસ્સા. ચતુ:સીમા: પુર્વ: સબ પ્લોટ પછી માર્જિન					
સ્પે	રપેશ, પશ્ચિમ:૭.૬૨ રોડ પછી પ્લોટ નં. ૧૪, ઉત્તર: ૭૪.૬૨ અંદરનો રોડ પછી પ્લોટ નં. ૫૮,				

ંઉપર જણાવેલ સબંધિત માંગણા નોટીસોમાં વધુ સારી રીતે જણાવ્યા મુજબ દરે અન્ય વ્યાજ, ચંડત વ્યાજ સહીત, જો જણાવેલ દેવાદાર(રો) સદરહું મુજબ ટીસીએચએફએલને ચુકવણી કરવા નિષ્ફળ જો તો ઉપરોક્ત સિક્ચોર્ડ એસેટ(ટો)/સ્થાવરમિલકત(તો) સામે જ્યાવેલ કાયદાની કલમ ૧૩(૪) અને લાગુ નિયમો **હેઠળ જ્યાવેલ દેવાદાર(રો)/કાનુની વારસદાર**(રો)/કાનુન પ્રતિનિધિ(ઓ) ના ખર્ચ અને પરિણામોના જોખર્મ કાર્ચવાહી કરવામાં આવશે. જ્યાવેલ દેવાદાર(રો)/કાનુની વારસદાર(રો)/ કાનુની પ્રતિનિધિ(ઓ) ને ટીસીએચએફએલની આગોતરી લેખીત મંજૂરી વગર વેચાણ, ભાડે અથવા અન્ય રીતે સદરહ સિક્ચોર્ડ એસેટ(ટો)ત્થાવર મિલકતોની તબદીલી કરવાની જણાવેલ એક્ટ હેઠળ મનાઇ કરમાવામાં આવે છે. એક્ટ અથવા તે હેઠળ બનેલ નિયમોની જોગવાઇઓનો ભંગ અથવા ભંગ કરવામાં સહાય કરનાર કોઇપણ વ્યક્તિ એક્ટ હેઠળ જણાવેલ જેલ અને/અથવા દંડને પાત્ર બનશે

દક્ષિણ: સબ પ્લોટ નં. ૧૬.

તારીખ : ૦૪.૦૯.૨૦૨૧ સ્થળ : ગુજરાત

ચુનિટ નં. એ-૭

ટાટા કેપિટલ હાઉસિંગ ફાચનાન્સ લીમીટેડ વતી

## માંગણા નોટીસ

સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩ (૧) સાથે વેચાતી સિક્યોરીટાઇઝેશન અને કીક્સ્ટ્ટક્શન ઓફ ફાયનાન્સિયલ એનેટ્સ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (એક્ટ) ની કલય ૧૩ (૨) હેઠળ. આઇઆઇએફએલ હોય ફાયનાન્સ લીમીટેડ (આઇઆઇએફએલ એચએફએલ) (અગાઉ ઇન્ડિયા ઇન્ડેયા ઇન્ફોલાઇન હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ તરીકે જાણીતી)ના અધિકૃત અધિકારીએ જણાવેલ નિયમોના નિયમ ૩ સાથે વેચાતી જણાવેલ એક્ટની કલમ ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઇપયોગ કરીને, દેવાદારોને તેમને જૂરી કરાયેલ સંબંધિત નોટીસ(સો)માં જણાવેલ રકમ પસ્ત ચુકવવા માટે જણાવ્યું હતું. ઉપરોક્ત અનુસંધાનમાં આથી એક વખત ફરી દેવાદારોને આ નોટીસના પ્રકાશનની તારીખથી ૧૦ દિવનસી અંદર અહી નીચે દર્શાવેલ રકમ, માંગણા નોટીસર્ન તારીખથી ચકવણીની તારીખ સંધીના ચડત વ્યાજ સહીત ચકવવા જણાવામાં આવે છે. દેવાદાર છો. માંગણા નોટીસની તારીખ મજબ બાકી રકમ અને લોનની રકમ પસ્ત ચકવા માટે અપાયેલ સિલ્યોરીટીને

દેવાદાર(રો)/જામીનદાર(રો) નું નામ	માંગણા નોટીસની તારીખ અને રકમ	સિક્યોર્ડ એસેટ (સ્થાવર મિલકત) ની વિગત
શ્રી પાર્થીવકુમાર જગદિશચંદ્ર દિસીત, શ્રી જગદિશભાઇ રમાશંકર દિસીત, શ્રી કુસુમળેન દિસીત, (પ્રોસ્પેક્ટ નં. ૮૨૩૨૪૫)	<b>૩૧.૦૮.૨૦૨૧ રૂા.૧૦,૪૮,૯૩૫/</b> – (રૂપિયા દસ લાખ અડતાલીસ હજાર નવસો પાંત્રીસ પુરા)	ડી–૨૦૩, ભેંભે માળ, એરિયા ક્ષેત્રફળ ૩૫.૦ શો.મી., મારૂતિ હાઇટ્સ, સર્વે નં. ૨૯૭, ટાઉ પ્લાનિંગ સ્કીમ નં. ૭૫, રણાસણ ટોલ ટેક્સ પારે એસ.પી. રીંગ રોડ, નરોડા, મુહિયા, અમદાવા ૩૮૨૪૦૫, ગુજરાત, ભારત ખાતેની મિલકતન તમામ ભાગ અને હિસ્સા.
શ્રી શૈલેષભાઇ શુકલા, શ્રીમતી ઉષાબેન શૈલેષભાઇ શુકલા (પ્રોસ્પેક્ટ નં. ૮૨૩૪૩૫)	<b>૩૧.૦૮.૨૦૨૧ રૂા. <i>૫</i>,૩૨,૭૩૪.૦૦/–</b> (રૂપિયા સાત લાખ બત્રીસ હજાર સાતસો ચૌત્રીસ પુરા)	ક્લેટ નં. સી ૫૦૫, પાંચમો માળ, દેવ માણે એપાર્ટમેન્ટર, એસ્ટિયા ક્ષેત્રકળ લ્પદ્દ ચો.મી., સર્વે ન ૧૫, ૧૬, ટાઉંન પ્રાનિંગ-સ્ક્રીને નં. ૮૦, કાઇંન્ડ ટર્ન. ૨, બળિયા દેવ મંદિર કેનાલ રોડ, વટવ અમદાવાદ, ૩૮૨૪૪૦, ગુજરાત ભારત ખાતેન્ મિલક્તના તમામ ભાગ અને હિસ્સા.
શ્રી સુરેશભાઇ જી. મારકભા, શ્રીમતી મંજુલાબેન એસ. મારકભા, એક્સ વે એન્ટટ્યાઇઝ (પ્રોસ્પેક્ટ નં. ૯૪૩૧૧૩, હદ્દ૮૦૦૫, હહ્વ૧૪હ)	3૧.૦૮.૨૦૨૧ પ્રોસ્પેક્ટ નં. ૯૪૩૧૧૩ રૂા. ૩,૧૯,૩૩૫/ – (રૂપિયા ત્રણ લાખ ઓગણીસ હજાર ત્રણસો પાંત્રીસ પુરા) પ્રોસ્પેક્ટ નં. હદ્દ૮૦૫ રૂા. ૨૬,૧૧,૮૩૨/ – (રૂપિયા છવ્વીસ લાખ અગિયાર હજાર આઠસો બગેસ પુરા) પ્રોસ્પેક્ટ નં. હ્ય૧૧૪૭ રૂા. ૧૧,૯૯,૪૧૬/ – (રૂપિયા અગિયાર લાખ નવ્યાણું હજાર ચારસો સોળ પુરા)	બી ૨૦૧, ક્ષેત્રફળ ૮૦૫ ચો.કુટ, બીજો માળ ઇસ્કોન રેસીડેન્સી, અવધ રેસીડેન્સી પાસે, માવ ગામ પાછળ, માવડી, મીડલ ક્લાસ, રાજકોટ પિનકોડ–૩૬૦૦૦૪, ગુજરાત, ભારત ખાતેન મિલકતના તમામ ભાગ અને હિસ્સા.
શ્રી ભાઇલાલ ચૌહાણ, શ્રીમતી સુરેખાળેન ચૌહાણ (પ્રોસ્પેક્ટ નં. ૮૨૨૩૫૬)	<b>૩૧.૦૮.૨૦૨૧ રૂા. ૫,૦૫,૪૬૩</b> /– (રૂપિથા પાંચ લાખ પાંચ હજાર ચારસો શ્રૈસઠ પુરા)	મોજે સોનીપુર, પંચમહાલના બિન ખેતીલાચ પ્લોટની જમીન પરના હાઉસ નં. ૩૨, ક્ષેત્રફ્ર્ડ ૬૮.૭૦ ચો.મી., રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સર ડિસ્ટ્રીક્ટ હાલોલ, જિલો પંચમહાલ, ભારત ખાતેન મિલકતના તમામ ભાગ અને હિસ્સા.
શ્રી નિતિન અમૃતસિંઘ ગીરસે, શ્રી અમૃત કિશિનાથ ગીરસે, શ્રીમતી નિર્મલા અમૃત ગીરસે, શ્રી સંદીપ અમૃતસિંઘ રાજપુત (પ્રોસ્પેક્ટ નં. આઇએલ૧૦૦૩૩૯૭૭)	<b>૩૧.૦૮.૨૦૨૧ રૂા. ૧૩,૭૯,૯૬૭/–</b> (રૂપિયા તેટ લાખ ઓગણએંસી હજાર નવસો સડસઠ પુરા)	બ્લોક નં. દૃ૭, પ્લોટ –૩૪૪/બી, એરિચા ક્ષેત્રફ્ર પપ.સ્ટ ચો.મી., મહાવીર નગર ટેસીડેન્સી, મુકા અને પોસ્ટ કારેલી, પલસાણા, સુટત,૩૯૪૩૧૦ સુટત, ગુજરાત, ભારત, ૩૯૪૩૧૦ ખાતેન મિલકતના તમામ ભાગ અને હિસ્સા.

જો જણાવેલ દેવાદારો આઇઆઇએફએલ એચએફએલને ઉપર જણાવ્યા મુજબ પરત ચુકવણી કરવામાં નિષ્ફળ જશે તો, આઇઆઇએફએલ એચએફએલ જણાવેલ એક્ટની કલમ ૧૩ (૪) હેઠળ અને લાગુ નિયમો મુજબ સંપૂર્ણ પણે દેવાદારોના જોખમ, ખર્ચ અને પરિણામો પર ઉપરોક્ત સિક્યોડે મિલકતો સામે કાર્યવાહી કરશે. વધુ વિગતો માટે અધિકૃત અધિકારીનો શાખા ઓફીસઃ અમદાવાદ કોમર્સ હાઉસ, ચોથો માળ, કોમર્સ હાઉસ ૪, શેલ પેટ્રોલ પંપ પાસે, આનંદનગર રોડ, પ્રહલાદનગર, અમદાવાદ-૩૮૦૦૫૧ અથવા શાખા ઓફીસ: ઓફીસ નં. ૭૦૧, સામો માળ, ૨૧ સેન્ચ્યુરી બિઝનેશ સેન્ટર, ઉર્ધના દરવાજા પાસે, રીંગ રોડ, સુરત-૩૯૫૦૦ અથવા કોર્પોરેટ ઓફીસ: આઇઓઇએફએલ ટાવર, પ્લોટ નં. ૯૮, ઉદ્યોગ વિહાર, ફેઝ-૪, ગુરૂગ્રામ, હરિયાણા ખાતે સંપર્ક કરવા વિનંતી છે. તારીખ : ૦૪–૦૯–૨૦૨૧

સહી/– અદિકૃત અદિકારી આઇઆઇએફએલ હોમ ફાયનાન્સ લીમીટેડ વતી (આઇઆઇએફએલ એયએફએલ)

# **AEGIS**

## એજીસ લોજિસ્ટીક્સ લીમીટેડ

CINL L63090GJ1966PLC001032 રજી. ઓફીસ : ૫૦૨, સ્કાંચલીના, છું.આઇ.ડી.સી. ચાર સ્ટતા, તામી-૩૯૬ ૧૯૫, જિલો–વતસ્સાડ, ગુજરાત કોર્પો. ઓફીસ : ૧૨૨૨, ટાવર બી, પેનિન્સ્યુલા બિઝનેસ પાર્ક, છું.કે માર્ગ, લોસ્ટાયરેલ (વેસ્ટ), મુંબઇ–૪૦૦ ૦૧૩ ફોને : +૯૧ ૨૨૬૬૬૬ ૩૬૬૬ ફેક્સ: +૯૧ ૨૨૬૬૬ ૩૭૦૭ ઇમ્પેક્સ: aegis@agisindia.com વેષ્યસાયદઃ પ્યખ્ય aegisindia.com

#### કંપનીનાં ઇક્વિટી શેરહોલ્ડરોને નોટીસ

કંપની કાયદા, ૨૦૧૩ ની કલમ ૧૨૪ (૬) સાથે વંચાતા ઇન્વેસ્ટર એજ્યુકેશન અને પ્રોટેક્શન કંડ ઓથોરીટી (એકાઉન્ટીંગ, ઓડિટ, ટ્રાન્સફર અને રીકંડ) નિયમો, ૨૦૧૬ મુજબ કંપનીના શેરહોલ્ડરોને નોટીસ આપવામાં આવે છે કે શેરહોલ્ડરો જેમણે સતત ગરિસત) વર્ષથી નાણાંકિય વર્ષ ૨૦૧૪ - ૧૫થી તેમના ડિવિડન્ડો માટે દાવી કરેલ નથી અથવા ચુકવણી કરેલ નથી, તેવા ડિવિડનોડોના સંબંધમાં ઇક્વીટી શેરો નાણાંકિય વર્ષ, ૨૦૧૪ - ૧૫ (વચગાળાના) ના દાવા -રહીત/ ન ચુકવાયેલ તેમજ તેમની ડિવિડન્ડની ૨કમ આઇઇપીએક ઓથોરીટમાં તબદીલ કરવામાં આવશે ું ઉપરોક્તને ધ્યાનમાં રાખીને શેરહોલ્ડરોની માહિતી અને જરૂરી પગલાં લેવા માટે શેરહોલ્ડરો જેમના નાણાંકિય વર્ષ ૨૦૧૪-૧૫ ના ઇક્વિટી શેરો અને ડિવિડન્ડ આઇઇપીએકમાં તબદીલીને પાત્ર છે તેમને સંપર્ણ વિગતો ધરાવતા નિવેદનો

અપલોડ કર્યા છે. શેરહોલ્ડરો તેમના બિનચુકવેલ અથવા વટાવ રહીત ડિવિડન્ડો માટે કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટને ઇમેઇલ્

કંપનીની વેબસાઇટ <u>www.aegisindia.com</u> (લિંક-<u>http://www.aegisindia.com/Dividend.aspx</u>) પ

કરીને ૧૦ સ્ત્રિમ્બર, ૨૦૨૧ ના રોજ અથવા એ પહેલા તેમના ડિવિડનો વરવા માટે દાવો કરી ગકે છે. લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રા.લિ. ચુનિટ-એન્ગુસ લોજિસ્ટીક્સ લીમીટેડ સી-૧૦૧, ૨૪૭ પાર્ક, એલબીએસ માર્ગ, વિખ્રોલી (બેસ્ટ), મુંબઇ – ૪૦૦ ૦૮૩. ફોન : ૦૨૨ ૪૯૧૮૬૨૭૦ / ઇમેઇલ : mt.helpdesk@linkintime.co.in કંપનીએ શેરહોલ્ડરોના નવા પ્રાપ્ત સરનામાં પર વ્યક્તિગત રીતે પહેલેથી જાણ કરી દીધી છે. જેમના ડિવિડન્ડો નાણાંકિય વર્ષ, ૨૦૧૪-૧૫ થી ૭ (સાત) સાત વર્ષ સુધી દાવા રહીત રહ્યા હતા અને તેમને તાત્કાલિક ધોરણે ડિવિડન્ડનો દાવો

**૧૦ ડિસેમ્બર, ૨૦૨૧** ના રોજ અથવા એ પહેલા આવી કોઇ લંબાવેલ તારીખ (જો કોઇ હોય તો) શેરહોલ્ડરો દ્વારા દાવા રહીત ડિવિડન્ડના સબંધમાં કોઇ યોગ્યા દાવા મળશે નહી, તો કંપની નિયમોમાં જણાવેલ આવશ્યકતાઓના અનુપાલનને ધ્યાનમાં રાખીને શેરો નિયમોમાં જણાવેલ પ્રક્રિયા મુજબ આઇઇપીએફ ઓથોરીટીમાં તબદીલ કરશે.આમ છતાં, લાગતા

વળગતા શેરહોલ્ડર ફોર્મ આઇઇપીએફ-પ ફાઇલ કરીને આઇઇપીએફ ઓથોરીટી પાસેથી જણાવેલ શેરો તેમજ દાવારહીત ડિવિડન્ડ(ડો) માટે દાવો કરી શકે છે. ાલવરના પ્રાપ્ત કરા કરા કરા છે. નોટીસની નકલ સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ <u>www.bseindia.com</u> અને <u>www.nseindia.com</u> પર પણ ઉપલબ્ધ છે. **એબ્ટિસ લોબિસ્ટીક્સ લીમીટેડ** 

મોનિકા ગાંદી

તારીખ : 03/૦૯/૨૦૨૧

સન ફાર્મા એડવાન્સ્ડ રિસર્ચ કંપની લીમીટેડ

સ્મુસ્ટર્ક ઓફીસ : પ્લોટ નાં પ અંગે દૃષિ, સાવલી, છું.આઇ.ડી.સી. એસ્ટેટ, સાવલી–વડોદરા હાઇવે, મંબુસર–૩લ્વ,કળ, કિલ્લો–વડોદરા, ગુજરાત એપોરેટ ઓફીસ : ૧૭/બી, મહલ ઇન્ડસ્ટ્રીચાલ એસ્ટેટ, મહાકાળી કેવ્સ રોડ, એપોરી ઇન્ટર, મુંબઇ–૪૦૦ ૦૯૩, મહારાષ્ટ્રા, ફોલ : +૯૧ ૨૨ દૃદૃજ્ય પદ્ભપ કૃષ્ક ફેક્સ : +૯૧ ૨૨ દૃદૃજ્ય પદ્ભપ CIN : L7310GJ.2006PL.C047837.

## વાર્ષિક સામાન્ય સભા, ઇ-વોટીંગ અને બુક બંધની નોટીસ

. તાથી અહીં નોટીસ આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની સોળમી વાર્ષિક સામાન્ય સભા બુધવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે વિડિયો કોન્ફરન્સીંગ (વીસી)/અન્ય ઓડિયો વિઝ્યુલ માધ્યમો (ઓએવીએમ) મારફત એક જ સ્થળે સભ્યોની પ્રત્યક્ષ હાજરી વગર કંપની કાયદા, ૨૦૧૩ (એક્ટ) ની લાગુ જોગવાઇઓ અને તે હેઠળ રચાયેલ નેયમો અને સિક્યોરીટીઝઅને એક્સચેન્જ બોર્ડઓફ ઇન્ડિયા (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ નેયમનો, ૨૦૧૫ (લિસ્ટીંગ નિયમનો)સાથે વંચાતા કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (''એમસીએ ") દ્વારા જારી કરાયેલ સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦ તારીખ ૦૮ એપ્રિલ, ૨૦૨૦, સામાન્ય પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩ એપ્રિલ ૨૦૨૦, સામાન્ય પરિપત્ર નં. ૨૦/૨૦૨૦ તારીખ ૫ મે, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૦૨/૨૦૨૧ તારીખ ા ૩ જાન્યુઆરી ,૨૦૨૧ અને અન્ય લાગુ પરિષત્રો (''એમસીએ પરિષત્રો") અને સિક્યોરીટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (''સેબી ") દ્વારા જારી કરાયેલ પરિષત્ર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તારીખ ૧૨મે. ૨૦૨૦સાથે વંચાતા પરિષત્ર નં. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તારીખ૧૫જાન્યઆરી ૨૦૨૧ અને અન્ય લાગુ પરિપત્રો, જો કોઇ હોય તો, (''સેબી પરિપત્રો") (એમસીએ પરિપત્રો અને સેબી પરિપત્રોને સંયુક્ત રીતે ''સંબંધિત પરિપત્રો" તરીકે દર્શાવેલ છે)અંતર્ગત એજીએમ બોલાવતી નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવ માટે યોજાશે. વીસી/ઓએવીએમ સવલત મારફત ભાગ લેનાર સભ્યોને એક્ટની કલમ ૧૦૨ હેઠળ કોરમની ગણતરી કરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે.

સબંધિત પરિષત્રો અનુસાર, નાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૧ ના વાર્ષિક અહેવાલો તેમજ એજીએમની નોટીસની ઇલેક્ટ્રોનિક કલો તમામ સભ્યો જેમના ઇમેઇલ એડ્રેસ કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ, લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ (આરટીએ) / ડિપોઝીટરીમાં નોંધાયેલ છે તેમને મેઇલ કરવામાં આવશે. જણાવેલ વાર્ષિક અહેવાલ અને મેજીએમની નોટીસ કંપનીની વેબસાઇટ <u>www.sparc.life</u> અને સ્ટોક એક્સચેન્જો એટલેકે બીએસઇ લીમીટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડની વેબસાઇટ અનુક્રમે <u>www.bseindia.com</u> અને www.nseindia.com પર અને એજીએમ માટે ઇ-વોટીંગ અને વીસી / ઓવીએએમ સવલતો પુરી પાડવા માટે કંપની દ્વારા નિમણુક કરાયેલ એજન્સી સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઇન્ડિયા) લીમીટેડ (સીડીએસએલ) ની વેબસાઇટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ રહેશે. સભ્યો ફક્ત વીસી / એવીએમ સવલત મારફત એજીએમમાં હાજ રી ગાપી શકે છે અને ભાગ લઇ શકે છે. એજીએમમાં જોડવા માટેની સુચનાઓ એજીએમની નોટીસમાં આપેલ છે. સભ્યોને મેજીએમની નોટીસમાં જણાવેલ તમામ સુચનાઓ અને ખાસ કરીને એજીએમમાં જોડવાની સુચનાઓ, રીમોટ ઇ-વોટીંગ મારફત અથવા એજીએમ દરમિયાન ઇ-વોટીંગથી મત આપવાની પ્રક્રિયા ધ્યાનથી વાંચવા વિનંતી છે.

કંપની એજીએમની નોટીસમાં જણાવેલ કાર્યો માટે ઇલેક્ટ્રોનિકલી તેમના મત આપવા (રીમોટ ઇ-વોટીંગ) ની સવલત તાપતા આનંદ અનુભવે છે. રીમોટ ઇ-વોટીંગ ગાળો રવાિર, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે શરૂ થશે અને મંગળવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સાંજે ૫ઃ૦૦ કલાકે પુર્ણ થશે. આ ગાળા દરમિયાન સભ્યો ીચે જણાવેલ લોગીન પ્રક્રિયા મુજબ લોગીન કરીને રીમોટ ઇ-વોટીંગથી તેમના મતો આપી શકે છે. ત્યારબાદ વોટીંગ માટે રીમોટ ઇ-વોર્ટીંગ મોડ્યુલ સીડીએસએલ દ્વારા બંધ કરવામાં આવશે. સેબીની આવશ્યકતાઓ મુજબ ઇ-વોર્ટીંગ ડીમેટ બ્રેકાઉન્ટ હોલ્ડરો માટે ડિપોઝીટરીઝ∣ડિપોઝીટરી પાર્ટીશીખ્ટની વેબસાઇટ/તેમના ડિમેટએકાઉન્ટ મારફત એકજ લોગીન વિગતોના માર્ગે કાર્યરત છે. શેરહોલ્ડરો નીચે આપેલ એક જ સરખી રીતથી એજીએમ દરમિયાન ઇ-વોટીંગ માટે અને વીસી/ઓએવીએમમાં જોડવા માટે લોગીન કરી શકે છે. રીમોટ ઇ-વોટીંગ, એજીએમ દરમિયાન ઇ-વોટીંગ અને વીસી/ઓએવીએમ દ્વારા એજીએમમાં જોડવા માટેની વિગતવાર સુચનાઓ/પ્રક્રિયાઓ એજીએમની નોટીસમાં આપેલ છેઃ

#### રીમોટ ઇ–વોટીંગ/એજીએમ દરમિયાન ઇ–વોટીંગ અને વીસી/ઓએવીએમ દુારા એજીએમમાં જોડાવા માટેની લોગીન પદ્ધતિ: ડીમેટ માં શેરો ધરાવતા વ્યક્તિગત શેરહોલ્ડરો સીડીએસએલ ઇઝી/ઇઝીએસ્ટ સવલત અથવા

કીઝીકલ સ્વરૂપે શેરો ધરાવતા શેરહોલ્ડરે અને ડિમેટ સ્વરૂપે શેરો ધરાવતા બિન વ્યક્તિગત શેરહોલ્ડરો કીઝીકલ સ્વરૂપે શેરો ધરાવતા શેરહોલ્ડરો અને ડીમેટમાં શેરો ધરાવતા બિન-વ્યક્તિગત શેરહોલ્ડરો જેમણે કંપની/આરટીએ/ ડિપોઝીટરી પાર્ટીશીપન્ટો પાસે તેમના પાન મપડેટ કરાવેલ નથી

મેનએસડીએલ આઇડીઇએએસ સવલત મારફત લોગી મથવા ડિપોઝીટરી પાર્ટીશીખ્ટ મારફત લોગીન કરીને. તેમના ડીપીઆઇડી/ક્લાઇન્ટ આઇડી અથવા કોલિયો ાંબરનો ઉપયોગ કરીને ઇ–વોટીંગ વેબસાઇટ <u>www.evotingindia.com</u> મારફત લોગીન ોમના ડીપીઆઇડી/ક્લાઇન્ટ આઇડી અથવા કોલિચે . ાંબરનો ઉપયોગ કરીને ઇ-વોટીંગ વેબસાઇટ www.evotingindia.com મારફત તેમજ કંપની/ આરટીએ દ્વારા અપાચેલ ઇ-વોટીંગ કોડ/સીકવન્સ ાંબરનો ઉપયોગ કરીને લોગીન અથવા શેરહોલ્ડરો તેના માટે કંપની/આરીટીએનો સંપર્ક કરી શકે છે.

૪ે સભ્યોના ઇમેઇલ એડેસો કંપનીના આરટીએ/ડિપોઝીટરીઓ પાસે ૨જીસ્ટર્ડ નથી તેઓ એજીએમની નોટીસમાં નોંધ વિભાગમાં આપેલ સુચનાઓ અનુસરીને લોગીન વિગતો બનાવી શકે છે. સભ્યો આ લોગીન વિગતોનો વીસી/ઓએવીએમ મારફત એજીએમમાં હાજર રહેવા માટે પણ ઉપયોગ કરી શકે છે.

જે સભ્યોના ઇમેઇલ આઇડી/મોબાઇલ નં. રજીસ્ટર નથી અથવા સુધારો કરાવેલ નથી તેઓને નીચેની પ્રક્રિયા અનુસરીને નેમના ઇમેઇલ આઇડી/મોબાઇલ નંબર રજીસ્ટર/સુધારો કરાવવા વિનંતી છે.

- એ) ભૌતિક સ્વરૂપે શરો ધરાવતા સભ્યો અને જેમણે કંપની / આરટીએમાં તેમના ઇમેઇલ એટ્રેસ/મોબાઇલ નંબર રજીસ્ટર સુધારો કરાવેલ નથી તેઓને ફોલિયો નંબરની વિગતો અને પાનકાર્ડની સ્વપ્રમાણીત નકલ secretarial@sparcmail.com અથવા કંપનીના આરટીએ <u>rnt.helpdesk@linkintime.co.in</u> પર લખી મોકલીને તે રજીસ્ટર / સુધારો કરાવા વિનંતી છે.
- ી) ડીમટીરીયલાઇઝ્ડસ્વરૂપે શેરો ધરાવતા સભ્યોને ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ(ટો)જેમા તેઓ તેમના ડીમેટ એકાઉન્ટ(ટો) નું સંચાલન કરે છે તેની પાસે તેમના ઇમેઇલ એડ્રેસ/મોબાઇલ નંબર રજીસ્ટર / સુધારો કરાવવા વિનંતી છે. વ્યક્તિનું નામ કટ-ઓફ ડેટ એટલે કે બુઘવાર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ કંપનીના સભ્યોના નોંધણીપત્રક બથવા ડિપોઝીટરી દ્વારા સંચાલિત લાભાર્થી માલિકોમાં નોંધાયેલ છે ફક્ત તેજ ઇલેક્ટ્રોનિક મતદાન પદ્ધતિ મારફત સભા ડરમિયાન રીમોટ ઇ-વોટીંગ/મતદાનની સવલતો મેળવવા હકદાર ગણાશે. સભ્યો જેમણે સભા પહેલા રીમોટ ઇવોટીંગ દ્વારા તેમના મતો આપ્યા છે તેઓ સભામા હાજર રહી શકશે, પરંતુ ફરીથી મત આપવા હકદાર ગણાશે નહી કોઇપણ વ્યક્તિ જે નોટીસ મોકલ્યા પછી કંપનીની સભ્ય બને છે અને કટ–ઓફ ડેટ એટલે કે બુધવાર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ શેરો ધરાવે છે અને જેમનો પૅન કંપનીમાં રજીસ્ટર્ડ નથી <u>rnt.helpdesk@linkintime.co.in<sub>/</sub>secretarial@sunpharma.com</u> પર આરટીએ / કંપનીને લખીને રીમોટ ઇ-વોટીંગના કાર્ય માટે ઇ-વોટીંગ કોડ મેળવી શકે છે.

બેજીએમમાં હાજર રહેવા અથવા ઇ-વોટીંગને લગતી કોઇપણ પુછપરછ અથવા સમસ્યાના કિસ્સામાં, સભ્યો helpdesk.evoting@cdslindia.com પર ઇમેઇલ લખી શકે છે અથવા ૦૨૨-૨૩૦૫૮૭૩૮ અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૩, ૦૨૨-૨૩૦૫૮૫૪૨ ઉપર સંપર્ક કરી શકે છે. રીમોટ ઇ-વોટીંગને લગતી કોઇપણ ફરીયાદોના કેસ્સામાં સભ્યો / લાભાર્થી માલિકો શ્રી રાકેશ દલવી, મેનેજર, સીડીએસએલ, એ વિંગ, ૨૫મો માળ, મેરેથોન ફ્યુચરેક્સ ાફતલાલ મિલ્સ કંપાઉન્ડ, એનએમ જોષી માર્ગ, લોઅર પારેલ (પુર્વ), મુંબઇ- ૪૦૦ ૦૧૩, મહારાષ્ટ્ર, ભારત પર લર્ખ શકે છે અથવા <u>helpdesk.evoting@cdslindia.com</u> પર ઇ-મેઇલ મોકલી શકે છે અથવા ૦૨૨-ર ૩૦૫૮૫૪૨/૪૩ પર કોલ કરી શકે છે.

બાથી અહીં નોટીસ આપવામાં આવે છે કે એક્ટની કલમ ૯૧ અને લિસ્ટીંગ રેગ્યુલેશન્સના નિયમન ૪૨ અન્વયે કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક ગુરૂવાર, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી બુધવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ યોજનાર એજીએમની તારીખ સુધી (બંને દિવસો સહીત) એજીએમના હેતુસર બંધ રહેશે.

> બોર્ડ ઓફ ડાચેરેક્ટર્સના આદેશથી સન ફાર્મા એડવાન્સ્ડ રિસર્ચ કંપની લીમીટેડ માટે દિનેશ લાહોટી



## ૩૦મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે શેખાવતી પોલી યાર્ન લીમીટેડ (કંપની) ના સભ્યોની ૩૦મી (ત્રીસમી) વાર્ષિક સામાન્ય સભા બુધવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ બપોરે ૨ઃ૦૦ કલાકે વિડિયો કોન્ફરન્સીંગ (વીસી) / અન્ય ઓડિયં વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) મારફત કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા જારી કરાયેલ (એમસીએ પરિપત્રો) સામાન્ય ષરિષત્ર નં.૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦ અને ૨૦/૨૦૨૦ અનુક્રમે તારીખ ૮ એપ્રિલ ૨૦૨૦, ૧૩ એપ્રિલ ૨૦૨૦ અને ૫ મે, ૨૦૨૦ અને સિક્યોરીટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી પરિપત્ર) જારી કરાયેલ પરિપત્ર નં SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તારીખ ૧૨ મે ૨૦૨૦ અન્વયે અને કંપની કાયદા, ૨૦૧૩ (એક્ટ)ની જોગવાઇઓ અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાયરમેન્ટસ) નિયમનો, ૨૦૧૫ (લિસ્ટીંગ નિયમનો) (સંયુક્તરીતે સંબંધિત પરિપત્રો તરીકે દર્શાવેલ છે) ના અનુપાલન હેઠળ ૧૨ઓગસ્ટ, ૨૦૨૧ તારીખની એજીએમ બોલાવતી નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવા માટે યોજાશે.

સંબંધિત પરિપત્રો મુજબ એજીએમની નોટીસ અને નાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના વાર્ષિક અહેવાલ વગેરે કંપનીન તમામ સભ્યો જેમના નામ ૨૭ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ રજીસ્ટર ઓફ મેમ્બર્સમાં હાજર છે અને જેમના ઇમેઇલ એડ્રેસં કંપની/ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ(ટો) પાસે ૨જીસ્ટર્ડ છે તેમને મોકલામાં આવશે. આ દસ્તાવેજો કંપનીની વેબસાઇટ <u>www.shekhawatiyarn.com</u> અને બીએસઇ લીમીટેડની વેબસાઇટ <u>www.bseindia.com</u> અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડની વેબસાઇટ <u>www.nseindia.com</u> પર પણ ઉપલબ્ધ રહેશે. સભ્યો વીસી/ઓએવીએમ મારફત આગામી એજીએમમાં હાજર રહી શકે છે અને ભાગ લઇ શકે છે અને આવા સભ્યોને કંપની કાયદા, ૨૦૧૩ની કલમ ૧૦૩ હેઠળ કોરમની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે

#### સભ્યોની ઇમેઇલ એડ્રેસો રજીસ્ટર/સુધારો કરાવવાની રીત નીચે આપેલ છે:

ભૌતિક સ્વરૂપે શેરો ધરાવતા હોય તો <u>compliance@shekhawatiyarn.com</u> ને ઇમેઇલ દ્વારા ફોલિયો નં શેરહોલ્ડરનું નામ, શેર સર્ટીફીકેટની સ્કેન્ડ નકલ (આગળ અને પાછળ), પાન (પાનકાર્ડની સ્વપ્રમાણીત સ્કેન નકલ) આધાર (આધાર કાર્ડની સ્વ પ્રમાણીત સ્ક્રેન નકલ), પુરી પાડવા વિનંતી છે.

- ડીમેટ સ્વ૩પે શેરો ધરાવતા હોય તો compliance@shekhawativarn.com પર ડીપીઆઇડી-ક્લાઇન્ આઇડી (૧૬ અંક ડીપીઆઇડી + ક્લાઇન્ટ આઇડી અથવા ૧૬ અંક- લાભાર્થી આઇડી), નામ, ક્લાઇન્ટ માસ્ટર અથવા સંયુક્ત એકાઉન્ટ સ્ટેટમેન્ટ, પાન (પાનકાર્ડની સ્વ પ્રમાણીત સ્કેન નકલ), આધાર (આધાર કાર્ડની સ્વપ્રમાણીત સ્કેન નકલ) પુરી પાડવા વિનંતી છે

## ઇ-વોટીંગ મારફત મત(તો) આપવાની રીત નીચે આપેલ છે:

વેબસાઇટ : www.shekhawatiyarn.com

ડીમટીરીયલાઇઝ્ડ સ્વરૂપે, ફીઝીકલ સ્વરૂપે શેરો ધરાવતા અને જેમણે તેમના ઇમેઇલ એડ્રેસ રજીસ્ટર કરાવેલ નથી તા સભ્યોએ રીમોટલી (રીમોટ ઇ-વોટીંગ) ની રીત એજીએમની નોટીસમાં આપેલ છે. આ વિગતો કંપનીની વેબસાઇ www.shekhawatiyarn.com ઉપર પણ ઉપલબ્ધ રહેશે.

- ઇલેક્ટોનિક મતદાન પદ્ધતિ મારકત મતદાનની સવલત એજીએમમાં પણ ઉપલબ્ધ રહેશે અને એજીએમમાં હાજ ર રહેના સભ્યો જેમણે રીમોટ ઇ-વોટીંગથી તેમના મત(તો) આપ્યા નથી તેઓ એજીએમમાં મત આપવા હકદાર ગણાશે - ઇ-વોટીંગ મારફત મત આપવા માટેની લોગીન વિગતો સભ્યોને ઇમેઇલથી પુરી પાડવામાં આવશે. જે સભ્યોને ઇમેઇલ મળ્યા નથી અથવા જેમના ઇમેઇલ એડ્રેસ કંપની/ડિપોઝીટીરી પાર્ટીશીપન્ટ(ટો) પાસે રજીસ્ટર્ડ નથી તેઓ એજીએમની

નોટીસમાં નોંધોમાં આપેલ સુચનાઓ અનુસરીને તે મેળવી શકે છે. આ લોગીન વિગતોનો વીસી/ઓએવીએમ મારફત એજીએમમાં હાજર રહેવા માટે પણ ઉપયોગ કરી શકાશે સ્થળઃ મુંબઈ તારીખઃ ૦૨.૦૯.૨૦૨૧ શેખાવતી પોલિ-યાર્ન લીમીટેડ વતી મીના એ.આગલ રજિસ્ટર્ડ ઓફીસઃ

CIN: L17120DN1990PLC000440 કંપની સેક્રેટરી અને સર્વે નંબર.૧૮૫/૧, નારોલી ગામ, કાનડી ફાટક પાસે, સિલવાસા, દાદરા અને નગર હવેલી, (કેન્દ્ર શાસિત) -૩૯૬ ૨૩૫ કમ્પ્લાઇન્સ ઓકિસ

JITF INFRALOGISTICS LIMITED CIN NO.: L60231UP2008PLC069245 Registered Office: A-1, UPSIDC Indl. Area, Nandgaon Road.

#### Kosi Kalan, Distt. Mathura - 281403, India Website: www.jindalinfralogistics.com, E-mail: contactus@jindalinfralogistics.com NOTICE OF THE 14TH ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 14th Annual General Meeting ("AGM") of the Company will be held on **Wednesday**, 29th September, 2021 at 01.30 P.M. at the registered office of the Company at A-1, UPSIDC Industrial Area, Nandgaon Road, Kosi Kalan, District Mathura-281403 (U.P.) to transact the business as set out in the Notice convening the said Annua

n compliance with the MCA Circulars and SEBI Circular dated May 12, 2020, Notice of the AGM along with the Annual Report for the F.Y. 2020-21 is being sent only through electronic node to those Members whose email addresses are registered with the Company/Depositories. Members whose email is not registered may note that the Notice and Annual Report for the F.Y. 2020-21 will also be available on the Company's website www.jindalinfralogistics.com, websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively. The Annual Report for the F.Y. 2020-21 along with Notice calling AGM have en sent on 03<sup>rd</sup> September 2021, to the Members of the Company who held shares as or

Notice is also hereby given that pursuant to section 91 of the Companies Act, 2013 and regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from 23<sup>rd</sup> September, 2021 to 29<sup>th</sup> September, 2021 (both days inclusive) for the purpose of AGM.

Further, pursuant to the provisions of section 108 of the Companies Act, 2013 read with rul 20 of Companies (Management and Administration) Rules, 2014 and regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing remote e-voting facility to its members to cast their vote electronically on the resolutions to be transacted at 14th AGM of the Company.

The member please note the followings:

September, 2021.

Place: New Delhi

Date: 03.09.2021

સહી/-

- The remote e-voting shall commence at 9.00 a.m. on Sunday, 26th September, 2021 and shall end at 5.00 p.m. on Tuesday, 28th September, 2021. The remote e-voting shall not be available beyond 5.00 p.m. on Tuesday, 28th
- The cut-off date for determining the eligibility of members for remote e-voting and voting through poll at AGM is 22<sup>rd</sup> September, 2021. Any person who becomes member of the Company after dispatch of notice of the meeting and holding shares as on cut-off date i.e.  $22^{\circ}$  September, 2021, may obtain the user id and password by contacting RCMC Shares Registry (Pvt.) Ltd., R & T Agent of
- the Company at B-25/1, Okhla Industrial Area Phase II, New Delhi 110020, phone 011-26387320-21, Fax-011-26387322, Email- evoting.services@rcmcdelhi.com. The members who cast their vote through remote e-voting may also attend the AGM but
- shall not be allowed to cast their vote at AGM. The facility of voting through poll shall be available at the AGM to those members who have not casted their vote through remote e-voting.
- Members may go through the e-voting instructions provided in the AGM Notice or visit https://evoting.nsdl.com and in case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for members and e-voting User Manual for members available at the download section of https://evoting.nsdl.com

For JITF Infralogistics Limited Kuma Company Secretar ACS-19819

# ઓસિયા હાથપર રિટેઇલ લીમીટેડ CIN: L52190GJ2013PLC077269

**૨૪૪૨૮ર્ડ ઓફીસ** : બેજમેન્ટ સ્ટોર ૧, ૪ડી સ્કવેર, આઇઆઇટી એન્જીનિચરિંગ કોલેજ સામે. ડી–માર્ટ વિસત ગાંધીનગર હાઇવે પાસે, મોટેરા, અમદાવાદ–૩૮૦૦૦૫. **ફોન** : (૦૭૯) રર૭૪૭૧૪૮ **ઇમેઇલ** : <u>cs2013.ohrl@gmail.com,</u> **વેબસાઇટ** : <u>www.osiahypermart.com</u>

#### ૮મી વાર્ષિક સામાન્ય સભા, બુકબંધ અને રિમોટ ઇ-વોટીંગની માહિતીની નોટીસ ાથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીની ૯મી વાર્ષિક સામાન્ય સભા (''એજીએમ'') ગુરુવાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧

ના રોજ બપોરે ૧ઃ૦૦ કલાકે વિડિયો કોન્ફરન્સીંગ (વીસી) / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) દ્વારા ાજીએમની ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ની નોટીસમાં જણાવેલ કાર્યો પા૨પાડવા માટે મળશે. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૦ ર ૧ માટેના વાર્ષિક અહેવાલને એજીએમની જાણ કરતી નોટીસ સાથે ઇલેક્ટ્રોનીક માર્ગે એ સભ્યોને રવાના કર્યો છે જેમના ડમેઇલ એડ્રેસ કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા જારી કરાયેલ તારીખ ૫ મે ૨૦૨૦, તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦, તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૦, તારીખ ૧૫ જૂન, ૨૦૨૦ અને ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ અને સેબીના પરિપત્ર તારીખ ૧૨ મે ૦૨૦ના અનુસાર કંપની પાસે અને/અથવા ડીપોઝીટરીઝ પાસે નોંધાયેલા છે. એજીએમ બોલાવતી નોટીસની સાથે વાર્ષિક મહેવાલ કંપનીની વેબસાઇટ www.asiahypermart.com અને નેશનલ સિક્યુરિટીઝ ડીપોઝીટરી લિમીટે એનએસડીએલ")ની વેબસાઇટ www.evoting.nsdl.com અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડર્ન બસાઇટ www.nseindia.com પર ઉપલબ્ધ છે.

આથી નોટીસ વધુમાં એ માટે આપવામાં આવે છે કંપની કાયદા, ૨૦૧૩ની કલમ ૯૧ કે જે તેની હેઠળના નિયમ સાથે વંચાય છે અને સેબી (એલઓડીઆર) રેગ્યુલેશન, ૨૦૧૫ના રેગ્યુલેશન્સ ૪૨, સભ્યોના રટિસ્ટર અને કંપનીની શેર ટ્રાન્સફર બુક કંપનીની ૮મી એજીએમ રાખવાના હેતુસર ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ (બંને દિવસો સહીત)સુધી બંધ રહેશે.

કંપની કાયદો ૨૦૧૩ની કલમ ૧૦૮ અને કંપનીઝ (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો, ૨૦૧૪ અને સેબી એલઓડીઆ૨) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના રેગ્યુલેશન ૪૪ અનુસાર કંપની તેના સભ્યોને એજીએમ દરમિયાન નોટીસમાં નિર્ધારિત ઠરાવો પર રિમોટ ઇ-વોટીંગ દ્વારા નીચે પ્રમાણે અને ઇ-વોટીંગની સવલત પૂરી પાડી રહી છે. કંપની કાયદો, ૨૦૧૩ અને તેની હેઠળ બનાવવામાં આવેલા નિયમોની જોગવાઇઓ અનુસા૨ જરૂરી હોવાથી વિગતો નીચે આપેલી છે . એજીએમની નોટીસની ફક્ત ઇમેઇલ માર્ગે ૩ સપ્ટેમ્બર, ૨૦૨૧

	રવાનગીની પૂર્ણતાની તારીખ		
₹.	રિમોટ ઇ-વોટીંગ શરૂ થવાની	સવારે ૯.૦૦ કલાકે ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧	
	તારીખ અને સમય		
з.	રિમોટ ઇ-વોટીંગ પૂર્ણ થવાની	સાંજે ૫.૦૦ કલાકે, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧	
	તારીખ અને સમય		
٧.	ઇ-વોટીંગ માટેની લાયકાતનાં હક્કો	૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧	
નક્કી કરવાની છેક્ષી તારીખ			
૫.	એવી વ્યક્તિઓ જેમણે શેર ખરીદ્યા છે અને કંપની દ્વારા એજીએમની નોટીસ ઇમેઇલ કર્યા પછી સભ્યો બન્યા		
	જે અને જેમના જેલી નારીએ ઇમનીના મુખ્યોના રહિલ્લામાં મીરોપીનીલ્લીય તારા જળવતામાં આવના લાભાર્થી		

	રિમોટ ઇ-વોટીંગ મારફતે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.		
ξ.	રિમોટ ઇ-વોટીંગની મંજૂરી આ પછી	સાંજે ૫.૦૦ કલાકે, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧	
	અપાશે નહી		
၅.	એજીએમ દરમિયાન (વીસી/ઓએવીએમ)	ઇ-વોટીંગ સવલત એજીએમ દરમિયાન ઉપલબ્ધ રહેશે.	
	ઠરાવો પર ઇ-વોટ્સ આપવાની રીત	જે સભ્યોએ એજીએમ પહેલા પોતાન રિમોટ િ-વોટીંગ મતઆપ્યો હોય તેઓ વીસી/ઓએવીએમ દ્વારા એજીએમમાં હાજર રહી શકે છે પરંતુ તેઓ એજીએમ	
		દરમિયાન તેમનો ઇ-વોટ આપવા માટે લાયક રહેશે નહી.	
۷.	ઇલેક્ટ્રોનીક વોટીંગ સિસ્ટમ અને	નેશનલ સિક્યુરિટીઝ ડીપોઝીટરી લિમીટેડ	

માલિકોના સ્ટેટમેન્ટમાં દેખાતા હોય તેઓ ઉપરોક્ત એજીએમની નોટસમાં દર્શાવેલ અનુસાર પ્રક્રિયાને પગલે

વીસી/ઓએવીએમ પ્લેટકોર્મ પ્રદાતા (એનએસડીએલ) www.evoting.nsdl.com જો સભ્યોને રિમોટ-ઇ-વોટીંગ માટે સવલતના સંદર્ભમાં કોઇ પ્રશ્ન હોય અને અન્ય કોઇ પ્રશ્ન હોય તો તેએ ાભ્યો માટેના ફ્રીક્વન્ટલી આસ્કડ ક્વેશ્વન્સ (એફએક્યુ) જોઇ શકે છે જે www.evoting.nsdl.com ન ાઉનલોડ વિભાગમાં છે અથવા ટોલ ફ્રી નં.ઃ ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦/૧૮૦૦-૨૨૪૦૪૩૦ પર કોલ કરી કે છે અથવા તેમની વિનંતી એનએસડીલ, ટ્રેડ વર્લ્ડ, એ વિંગ, ૪થો માળ, કમલા મિલ્સ કંપાઉન્ડ, સેનાપતી બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઇ - ૪૦૦૦૧૩ પર www.evoting.nsdl.com અથવા ટેલિફોન નંબર પર મોકલી શકે છે.

બોર્ડ ઓક્ ડાચરેક્ટરનાં હકમથી ઓસિયા હાયપર રિટેઇલ લીમટીંડ વતી, સહી/

સ્થળ : અમદાવાદ તારીખ : ૦૪.૦૯.૨૦૨૧

યુસુફ રૂપાવાલા કંપની સેક્રેટરી અને કમ્પલાયન્સ ઓફીસર

સહી/– અધિકૃત અધિકારી સ્થળ: મુંબઇ તારીખ: ૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ કંપની સેક્રેટરી અને કમ્પલાયન્સ ઓફીસર